



August 3, 2024

To, **BSE Limited.** Phiroze Jeejeebhoy Towers Dalal Street, Fort. Mumbai – 400001

Dear Sir/Madam,

Sub.: Newspaper advertisement of 39<sup>th</sup> Annual General Meeting ("AGM") to be held through Video Conference / Other Audit Visual Means

Ref.: Vishal Fabrics Limited, Scrip Code: 538598, Security ID: VISHAL

Dear Sir / Madam,

Pursuant to the Regulation 47 and 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Circular No. 14/2020 dated April 08, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 05, 2020, 02/2021 dated January 13, 2021, 21/2021 dated December 14, 2021, 02/2022 dated May 05, 2022 and 10/2022 dated December 28, 2022 and subsequent circular issued in this regard, the latest being General Circular No. 09/ 2023 dated 25th September, 2023 (collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs (hereinafter referred to as "MCA Circulars"), please find enclosed herewith copies of newspaper advertisement published in Financial Express (Gujarati and English Edition) on 03rd August 2024 intimating about 39th AGM of the Company to be held through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) on Tuesday, 27th August, 2024 and information on related matters as required under the MCA Circulars.

You are requested to take the same on your record.

Thanking you,
For VISHAL FABRICS LIMITED

Pooja Dhruve Company Secretary

M. No A48396

## RAJKOT INVESTMENT TRUST LIMITED

CIN:L65910GJ1982PLC005301 Regd. Office: 526 Star Chambers Harihar Chowk, Rajkot-360001, Gujarat Corporate Office: M-23, Super Tex Tower Opposite Kinney Talkies, Ring Road, Surat-395002, Gujarat IN | Ph. No.: 079-26422081 Website: www.ritl.co.in | E-mail: Info@ritl.co.in

## EXTRACT OF UN-AUDITED STANDALONE FINANCIAL **RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2024**

SI Vo.	Particulars	3 Months Ended June 30, 2024	Preceding 3 Months Ended March 31, 2024	Corresponding 3 Months Ended June 30, 2023	Year Ended March 31, 2024
		(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Audited)
1.	Total income from operations (net) Net Profit / (Loss) for the period (before Tax,	22.54	35.43	2.64	43,77
	Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax	7.33	19.63	(2.84)	9.87
	(after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after	7.33	19.63	(2.84)	9.87
5.	Exceptional and/or Extraordinary items)	7.33	15.26	(2.84)	5.50
	tax) & Other Comprehensive Income (after tax)]	7.33	15.26	(2.84)	5,50
į.	Equity Share Capital	100.00	100.00	100.00	100.00
3.	Other Equity excluding Revaluation Reserve Earnings Per Share (of Rs.2/- each) (for continuing and discontinued operations)	357.81	357.81	352.31	357.81
	Basic : Diluted:	0.73 0.73	1.53 1.53	-0.28 -0.28	0.55

30, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure) Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the the website of the Company i.e. www.ritl.co.in and on the website of BSE Limited (www.bseindia.com)

For, RAJKOT INVESTMENT TRUST LIMITED

Shrikrishna Baburam Pandev

M/s. Cholamandalam Investment and Finance Company Limited

(Managing Director)

DIN: 07035767

Date: 02.08.2024 Place: Surat

Place : Surat

Chola CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED

## Enter a better life Corporate Office: Chola Crest, Super B, C54 & C55,4, Thiru Vi Ka Industrial Estate, Guindy, Chennai-600 032 APPENDIX IV [See rule 8 (1)] POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas, the undersigned being the Authorized Officer of Cholamandalam Investment and Finance Company Limited, under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002), and in exercise of the powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated mentioned below under Section 13(2) of the said Act calling upon you being the borrowers (names and addresses mentioned below) to repay the amount mentioned in the said notice and interest thereon within 60 days from the date of receipt of the said notice. The borrowers mentioned herein below having failed to repay the amount, notice is hereby given to the borrowers mentioned herein below and to the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on me under subsection (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002. The borrowers mentioned here in above in particular and the public in general are hereby cautioned not to deal with said property and any dealings with the property will be subject to the charge of M/s. Cholamandalam Investment And Finance Company Limited for an amount as mentioned herein under and interest thereon. The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

NAME AND ADDRESS OF BORROWER/S & LOAN ACCOUNT NUMBER	DATE OF DEMAND NOTICE	OUTSTANDING AMOUNT	DESCRIPTION OF THE PROPERTY POSSESSED	DATE OF POSSESSION
Loan A/c Nos. HL23STR000085593 Mr/mrs. Babubhai Govindbhai Aambaliya Mr/mrs. Hetalben Aambaliya Mr/mrs. Sagar Aambaliya Mr/mrs. Yash Aambaliya Mr/mrs. Yash Aambaliya All Are Residing At: Plot 4/5 Flat No 101 Jay Bhavani Complex, singanpore Katargam Surat, opp Parth Complex, Surat, 395004. Also At: Rs No. 505/2-1, Tps No.18, Fp No.90, F. No.101, 1st Fi, P. No.4 And 5, Opp. Parth Complex, Siganpore Road, Jay Bhavani Complex, Ranchodnagr Co. Op. Hsg. Soc. Ltd., Katargam, Surat, Gujarat - 395004.	22-05-2024	Rs.2199844/- (Rupees Twenty One Lakhs Ninety Nine Thousand Eight Hundred Forty Four Only) as on 21-05-2024	All the piece and parcel of immovable property bearing flat no.101 on the 1st floor admeasuring 995.00 sq.fts. i.e.92.4355 sq.mts., super built up area 59.976 sq.mts built up area along with undivided share in the land of road & cop in jay bhavani compalex counstructed on plot no. 4 & 5 of ranchhod nagar co.op. housing society situated at R.S. NO.505/2-1, T.P. SCHEME NO.18 ,F.P. NO.90 paikee of moje village: katargam sub-dist. surat city, dist .surat owe(1)HETALBEN BABUBHAI AMBALIYA & (2)BABUBHAI GOVINDBHAI AMBALIYA. FOUR BOUNDRIES :EAST - F.NO.102 , WEST -ADJ.PASSAGE , NORTH-ADJ. BUILDING, SOUTH-PASSAGE	-20
Date : 30-07-2024			AUTHORISED OFFICER,	

BAJAJ HOUSING FINANCE LIMITED B FINSERV

Corporate office: Cerebrum IT Park B2 Building 5th floor, Kalyani Nagar, Pune, Maharashtra 411014 BARODA Branch: 4th floor, RK Plaza, 409-410, R.K. Plaza, Diwalipura, Vadodara-390007. Gujarat, SURAT BRANCH: Office no 402, 4th floor, Aastha Corporate Capital, VIP road, Bharthana Surat 395007, VAPI BRANCH: 2Nd Floor, Vikas Brothers, Near Upasana School, behind Gunjan Cinema, GIDC, Vapi, Gujarat 396195, AHMEDABAD BRANCH: 4th Floor, Aurum Avenue, Opp- Mayer Bungalow, Nr- Lawgarden, Elisbridge, Ahmedabad - 380006

## Demand Notice Under Section 13 (2) of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.

Undersigned being the Authorized officer of M/s Bajaj Housing Finance Limited, hereby gives the following notice to the Borrower(s)/Co-Borrower(s) who have failed to discharge their liability i.e. defaulted in the repayment of principal as well as the interest and other charges accrued there-on for Home loan(s)/Loan(s) against Property advanced to them by Bajaj Housing Finance Limited, and as a consequence the loan(s) have become Non Performing Assets. Accordingly, notices were issued to them under Section 13 (2) of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and rules there-to, on their last known addresses, however the same have been returned un-served/undelivered, as such the Borrower(s)/Co-Borrower(s) are hereby intimated/informed by way of this publication notice to clear their outstanding dues under the loan facilities availed by them from time to time.

Address of the Secured/ Mortgaged

Co-Borrower(s)/ Guarantor(s) & Addresses	Immovable Asset/ Property to be enforced	Date & Amount
Branch: BARODA LAN No. 413HSL83602585 1, DIVYABEN VAIRAGI (Borrower) At E/79 Swaminarayan Society, Near Shastri Baug, Panigate, Ajwa Road Vadodara-390019 ALSO AT: Flat No D501 Fifth Floor Shreeji Villas, Near Dmart Nr Bhakti Tenement D Mart Waghodia Road Village Danteshwar Baroda-390004	Property described as: Flat No D-501 Fifth Floor Shreeji Villas, Near D-mart Nr. Bhakti Tenement D Mart Waghodia Road Village Danteshwar Baroda, Gujarat-390004. East :- Flat D 502, West :- 7.5 Mtr	22nd July 2024 & Rs.28,45,030/- (Rupees Twenty Eight Lac Forty Five Thousand Thirty Only)
Branch: SURAT LAN No. H428HHL0943801 and H428HLT0950987 1. Jodhani Rakeshbhai Pravinbhai (Borrower) 2. Jodhani Kajalben Rakeshbhai (Co-Borrower) At A 404 Hetvi Heights, Behind Gopinath Society, Mota Varachha Chorasi, Surat, Gujarat-394101	All that right title and interest of property bearing Plot No. 102 (as per KJP Block No. 399/B/102) admeasuring 66.80 sq mtrs along with 35.57 sq mtrs undivided share in the land of Road & C.O.P., total admeasuring 102.37 sq mtrs in Rajeshwari Society, situated at Revenue Block No. 399 admeasuring 7-43-23 sq mtrs paiki 65622 sq mtrs of Moje Kamrej. Dist Surat. East: Plot No. 93, West: Society Road North: Plot No. 103, South: Plot No. 101	8 Rs.26,30,657/- (Rupees Twenty Six Lac Thirty Thousand Six
1. MAAN GLASS AND LAMINATES proper (Borrower) Through its Proprietor/ House Authorised Signatory/ Managing mtrs a	fule of property: 01- All that pieces and parcel of the ty being residential Flat No 103 bearing Vapi Nagarpalika No 3/1763 admeasuring about 690 sq feet i . e . 64.10 so long with undivided share in land admeasuring about 10.5 ters , lying and located on ground floor of Building No 2	8 Rs.35,70,256/- (Rupees Thirty

Shopping Centre, GIDC Vapi 396191 known as Mani Co Operative Housing Society Limited, 2. VELJI R RITA (Through Legal heir constructed on N A land bearing Survey No 221/4, admeasuring Thousand Two since deceased) Co- Borrower AT 103/B about 741 sq mtrs bearing City Survey No 1393 Situated within Hundred Fifty Wing Mani Co Op Hou Soc Alkapuri B/h the limits of Vapi Nagarpalika , Taluka Vapi Dist Valsad Six Only) Kumar Shala Vapi, West Pardi, Vapi396191 Also At : Flat No 203, A Wing, Vraj
Schedule of property: 02 - All that pieces and parcel of the property being Darshan, Near Dadra Check Post, Village residential Flat No 203, admeasuring about 686 sq feets i.e. 63.73 sq mtrs super built Dadra Of Union Territory of Dadra And up area lying and located on 2nd Floor of the building known as Vraj Darshan-A. Nagar Haveli Also At: Shop No 09, A Wing, constructed on N.A. Land bearing Plot No 02, admeasuring about 1200 sq mtrs and

Vraj Darshan, Near Dadra Check Post, Survey No 160/2, admeasuring about 1900 sq meters situated at Vil Lage Dadra of Village Dadra of Union Territory of Dadra the Union Territory Of Dadra And Nagar Haveli Schedule of property: 03: All that pieces and parcel of the property being Shop No 3. RANI VELJI RITA (Through Legal heir 9, bearing Dadra Gram Panchayat No 1896(9), admeasuring about 20.16 sq mtrs since deceased) (Co-Borrower) At 103/B | buper built up area lying and located on Ground Floor of the building known as Vraj Wing Mani Co Op Hou Soc Alkapuri B/h Darshan - A, constructed on N.A. Land bearing Plot No 160/2, admeasuring about Kumar Shala Vapi West Pardi , Vapi-396191 1900 sq meters situated at Village Dadra of the Union Teritory of Dadra And Nagar

	Haveii
Branch: VAPI LAN No. H584EC H584HLP0327144	N0401769 and
1. PIYUSH PATEL (Borrower)	
At F6/106 First Floor Chirag Udhyo	

Loan Account No./Name of the Borrower(s)/

ndustries | Society Limited, Near Shubham Tower-2 | Lac Thirty Eight Estate Somnath Daman -396210 Also At : Row House No 36 Shree Chala Co Op Hsg Soc Ltd, Vapi, Gujarat, 396191. 2. NAYANABEN PATEL (Co-Borrower) Also At : Row House No 36 Shree Chala Co Op Hsg Soc Ltd, Vapi, Gujarat, 396191.

Branch: AHMEDABAD LAN No. H418HLD0349807 All that piece and parcel of the Nonand 418THLEB226656 1. PRITAM SAKARIA (Borrower) 2. AASHKA SAKARIA (Co-Borrower) At Block O/701

Parishkar-1 Khokhra Circle, Ahmedabad -380026

agricultural Property described as: D- Rs.66,18,110/- (Rupees Sixty 1301 Green Glades, Godrei Garden City, Ahmedabad, Gujarat-382470

All that piece and parcel of the Non- 20th July 2024 & agricultural Property described as Row Rs.56,38,324/-

House No 36, Shree Chala Co Op Housing (Rupees Fifty Six

Opp Vapi Nagar Seva Sadan, Vapi-daman Thousand Three

Road, Mouie Chala, Sub Dist Pardi Dist

Valsad - 396191. East : Adi Property, West

Row House No 37, North : Adj Row

C06, North : Internal Road, South

Block No C11 And C12

House, South : Adj Land And Road

One Hundred Ten Only) Branch : BARODA LAN No. H413ECN0362224 & H413HLP0182278 All that piece and parcel of the 25th July 2024 Non-agricultural Property Rs.62,88,123/described as: Plot No C-7 And C-8 , Vrajdham S.T.B. Employees Co (Rupees Sixty Op Ho Society, Behind Bank of Two Lac Eighty Baroda, Susen Tarsali Ring Road, Eight Thousand One Hundred Tarsali, Vadodara 390009. East :

Twenty Three

Only)

25th July 2024 &

Six Lac Eighteen Thousand

Hundred Twenty

Four Only)

1. SGS INNOVATIONS (Borrower) (Through its Proprietor/Authorised Signatory/Managing Director) At 856/18 GIDC Estate Makargura Ind Vadodara 390010, 2. CHITRA BHOLANATH NINGOO (Co-Borrower), 3. KAJAL K NINGOO (Co-Borrower), 4. KAMAL BHOLENATH NINGOO (Co-Borrower) All 2, 3 & 4 are at: At C-8, Vrajdham Society Sussen, Tarsali Ring Road, Baroda, Gujarat-390009, 5. DEEPAK B NINGOO (Co-Borrower), 6. HEMNA D NINGOO (Co-Borrower) Both 5 Block No C09, West : Block No & 6 At C-7, Vrajdham Society Sussen, Tarsali Ring Road, Baroda, Gujarat-390009

Branch: SURAT LAN No. H428HHL1054425 & H428HLT1057779 1. Sureshbhai Prabhabhai Chaudhari (Borrower) 2. Ashaben Sureshbhai Chaudhari (Co-Borrower)

agricultural Property described as: Flat No. 702, 7th Floor, Building B/3, White Palace, Plot No. 55, Tp No. 67, Block, No. 1317, At B3-702 White Palace, Variyav Village Chorasi, Surat, Revenue Survey No. 1360, Surat-394107

All that piece and parcel of the Non-25th July 2024 & Rs.17,54,230/-(Rupees Seventeen Lac Fifty Four Thousand Two

Hundred Thirty Only) This step is being taken for substituted service of notice. The above Borrowers and/or Co-Borrowers Guarantors) are advised to make the payments of outstanding, along with future interest within 60 days from the date of publication of this notice failing which (without prejudice to any other right remedy available with Bajaj Housing Finance Limited) further steps for taking possession of the Secured Assets/ mortgaged property will be initiated as per the provisions of Sec. 13(4) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. The parties named above are also advised not

to alienate, create third party interest in the above mentioned properties. On which Bajaj Housing Finance Limited has the charge. Place: GUJARAT Date: 03 Aug 2024 Sd/- Authorized Officer, Bajaj Housing Finance Limited



KALAWAD ROAD BRANCH:

Kalawad Road, Kailashnagar, Rajkot -Bank of Baroda Ph. No. : 0281 - 2433650, 2451368

POSSESSION NOTICE (For Immovable property/ies) (As per Appendix IV read with rule 8(1) of the Security Interest (Enforcement) Rules, 2002)

Whereas the undersigned being the Authorised Officer of the Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 04-05-2024 calling upon the Borrowers Mr. Keval Vinodbhai Uchhadiya S/o Vinodbhai Chhaganbhai Uchhadiya, Mrs. Vilasben Vinodbhai Uchhadiya W/o Mr. Vinodbhai Chhaganbhai Uchadiya and Mr. Vinodbhai Chhaganbhai Uchhadiya S/o Chhaganbhai Mohanbhai to repay the amount mentioned in the notice being Rs. 9,99,464.36 (Rs. Nine Lakh Ninety Nine Thousand Four Hundred Sixty Four Rupees and Thirty Six Paisa only Plus further interest and other charges from 05-05-2024) within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on this 2nd day of August of the year 2024.

The Borrower/Guarantors/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda for an amount of Rs. 9,99,464.36 (Rs. Nine Lakh Ninety Nine Thousand Four Hundred Sixty Four Rupees and Thirty Six Paisa only Plus further interest and other charges from 05-05-2024) and interest

The Borrowers attention is invited to provision of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

## Description of the Immovable Property

Equitable Mortgage of Residential Flat No. E 502 having built up area 32.89 Sq. Mtrs., 5th Floor, Wing - E, situated at Vraj Villa Flats, Village : Vavdi, City : Rajkot, District - Raikot. State - Gujarat - 360 001, belonging to Mrs. Vilasben Vinodbhai Uchhadiya. Bounded Description:

East: Lift Open To Sky And Margin And Thereafter Govt Wasteland West: Open To Sky And Flat No. E 501 North: Open To Sky And Margin

South: Passage And Flat No. E 504 Date: 02.08.2024 Place: Rajkot

(Sandeep Lohchab, Chief Manager) Authorized Officer, Bank of Baroda

'કોર્મ નં. આઇએનસી–૨૫એ'' ઝખબારમાં પ્રકાશિક થનારી જાહેરાત ખાનગી કંપની તથા જાહેર કંપની ના રૂપાંતર માટે રીજનલ ડાયરેક્ટર, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અકેર્સ, ઉત્તર-પશ્ચિમ રીઝન, અમદાવાદ સમક્ષ કંપનીઝ એંક્ટ ૨૦૧૩, કંપનીઝ એક્ટ ૨૦૧૩ ની કલમ ૧૪ અને કંપનીઝ (ઇન્કોર્પોરેશન) રૂલ ૨૦૧૪ ના રૂલ ૪૧ ના સંદર્ભમાં. અને

ફ્લેવ ફૂડ બેવરેજીસ લિમિટેડ (CIN: U51909GJ1994PLC022221)

ના સંદર્ભમાં જેમની રજીસ્ટર્ડ ઓફીસ પ્લોટ નં.-૧૪૦, હઝુરી કમ્પાઉન્ડ, ક્રોપ સર્કલ પાસે, ઉદ્યના-મગદલ્લા રોડ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૨. ...અરજદાર કંપની

સામાન્ય જનતાને અહીં નોટીસ દ્વારા જણાવવામાં આવે છે કે કંપનીની ૩૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ યોજાયેલી વધારાની સામાન્ય સભામાં કંપનીઝ એક્ટ ૨૦૧૩ની ક્લમ ૧૪ સાથે વાંચતા ઉપર જણાવેલ નિયમો હેઠળ કંપની દ્વારા પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં ૩પાંતર થવાની ઈચ્છા ધરાવતો ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને પોતાની આ ઈચ્છાને અમલમાં મુકવા માટે કંપની કેન્દ્ર સરકારને અરજી કરવા માંગે છે.

કંપનીના આ સચિત કેરકાર/સ્ટેટસમાં રૂપાંતર સામે જો કોઈ વ્યક્તિના હિતનું ખંડન થઈ રહ્યું હોય તો તેઓ રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા પોતે ઉપાડી રહેલા વાંધો અથવા વાંધાનું કારણ, પોતાના હિતોની વિસ્તૃત માહિતી અને શા માટે આ વાંધો લઈ રહ્યાં છે એ વિશે એક્ડિવિટ કરાવીને રીજન કાચરેક્ટર, ઉત્તર પશ્ચિમ રીજન, આરઓસી ભવન, રૂપલ પાર્ક સોસાયટીની સામે, અંકુર બસ સ્ટેન્ડની પાછળ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ ખાતે આ નોટીસ પ્રકાશિત થયાના ૧૪ દિવસની અંદર મોકલાવી શકે છે, જેની એક નકલ કંપનીની સજીસ્ટર્ડ ઓફિસના નીચે જણાવેલ એડેસ પર પણ મોકલવાની રહેશે :-

બોમ્બે શોપીંગ સેન્ટર, રેસકોસ સર્કલ, વડોદરા, ગુજરાત, ઇન્ડિયા-૩૯૦૦૦७. અરજદાર માટે તેમના વતી ફ્લેવ ફૂડ બેવરેજીસ લિમિટેડ સહી/-

અલ્લાસ મોહસીનભાઈ હાઝુરી (डाथरेंड्सर) તારીખ : 03-0૮-૨૦૨૪ ડીઆઇએન: ૦૨૩૦૯૮૮૧

Name of the title holder

Ms. SUMITABEN

DHANANI &

Mr. VASANI

TULSIKUMAR

केनरा बैंक Canara Bank 📣 **OLD SACHIVALAYA BRANCH** #4 & 5, AZAD SOCIETY (BEHIND SAHAJANANDA COLLEGE). fertisene Syndicate

## DEMAND NOTICE [SECTION 13(2)] TO BORROWER/ GUARANTOR/MORTGAGOR

Ref: OLDSCH/DEMAND/CE/2024-25/SM

OLD SACHIVALAYA, AHEMDABAD

Date: 26.07.2024

BOTTOWER : M/s. CHITRAKUT ENGINEERING (Prop. SUMITABEN DHANANI) A-5. KRUSHNANAGAR SOCIETY, INDIA COLONY-BAPUNAGAR ROAD, BAPUNAGAR, AHMEDABAD, GUJARAT-380024 M/s. CHITRAKUT ENGINEERING (Prop. Ms. SUMITABEN DHANANI) 1/A SAKARIBA ESTATE, BH. INDO-GERMAN TOOL ROOM, NR. WATER TANK PHASE-IV, G.I.D.C VATVA, AHMEDABAD, GUJARAT-382440.

Borrower: Ms. SUMITABEN DHANANI, W/O. PRAVINBHAI, A-5 KRUSHNANAGAR SOCIETY, INDIA COLONY, BAPUNAGAR ROAD, BAPUNAGAR ROAD, AHMEDABAD CITY, GUJARAT-380024

Mortgagor/: Mr. VASANI TULSIKUMAR, S/O GOKULBHAI, B-3 AMARDIP TENAMENT, NEAR RATANBA SCHOOL, THAKKAR BAPA NAGAR, AHMEDABAD CITY, TB NAGAR, GUJARAT-382350

Dear Sir Sub: Notice issued under Section 13(2) of the Securitisation & Reconstruction of Financial Assets &

Enforcement of Security Interest Act, 2002. You have availed following Loans / Credit Facilities from our Old Sachivalaya Branch from time to time:

SI. No.	Loan No.	Nature of Loan/Limit	Principal	Interest and other charges	Total Liability	Rate of Interest
1	0281766000057	Term Loan	Rs. 1,70,743.65	Rs. 19,079.93	Rs. 1,89,823.58	12.65 % (Inclusive of Penal Interest @ 2%)

hereunder, by virtue of the relevant documents executed by you in our favour. Since you had failed to discharge your liabilities as per the terms and conditions stipulated, the Bank has classified the debt as NPA on18.06.2024 Hence, we hereby issue this notice to you under Section 13(2) of the subject Act calling upon you to discharge the entire liability of the Borrower towards the secured creditor as on 20.07.2024 amounts to Rs. 1,89,823.58 (Rupees One Lakh Eighty-Nine Thousand Eight Hundred Twenty-Three and paisa fifty-eight only) in Term Loan together with further interest and charges from 21.07.2024 + further Interest and charges thereon,, with accrued and up-to-date interest and other expenses, within sixty days from the date of the notice, failing which we shall exercise all or any of the rights under Section 13(4) of the subject Act. Further, you are hereby restrained from dealing with any of the secured assets mentioned in the schedule in any manner whatsoever,

without our prior consent. This is without prejudice to any other rights available to us under the subject Act and/or any other law in force. Your attention is invited to provisions of sub-section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem

The demand notice had also been issued to you by Registered PostAck due to your last known address available in the Branch record.

I) D	I) Details of Movable assets					
SI. No.	Description	Name of the title holder				
1	1.Machinery, Stock & Book Debt purchased out of bank's finance kept at factory premises of M/S CHITRAKUT ENGINEERING (Prop. Ms. SUMITABEN DHANANI) 1/A SAKARIBA ESTATE, BH INDO- GERMAN TOOL ROOM, NR. WATER TANK PHASE IV, G.I.D.C VATVA, AHMEDABAD, GUJARAT-382440 or at any other place by the borrower	ENGINEERING				

II) Details of Immovable assets Description The immovable property being Shed No. B/63 admeasuring about 84.15 sq. mtrs. Plot Area and admeasuring 69.61 sq. mtrs. construction in scheme known as "Shri Ram Estate" constructed on the land bearing Final Plot No. 101/1/2 admeasuring 14374 sq. mtrs. Of T.P.S. No. 111 (Nikol-Kathwada), Survey No. 78 Hissa No. 1 situate lying and being at Mouje Nikol of Taluka-Asarwa in the Registration District of Ahmedabad and Sub-District of Ahmedabad-12 (Nikol) Bounded as : East: Road West: Shed No. B/40 North: Shed No. B/62 South: Shed No. B/64

Authorised Officer CANARA BANK Date: 26.07.2024 Place: Ahmedabad

VISHAL FABRICS LTD

## VISHAL FABRICS LIMITED

(CIN: L17110GJ1985PLC008206) Regd. Office: Shanti Corporate House, Near Hira Rupa Hall, Bopal - Ambli Road, Ahmedabad-380058, Gujarat

Phone: +91 90999 52542; E-mail: cs.vfl@vishalfabrics.co.in Website: www.vishalfabricsltd.com

## NOTICE TO THE MEMBERS FOR 39TH ANNUAL GENERAL MEETING

Dear Members,

Notice is hereby given that the 39th Annual General Meeting ("AGM") of the Vishal Fabrics Limited (the "Company") will be convened on Tuesday, 27th August, 2024 at 02:00 p.m. (IST) through Video Conferencing ("VC") /Other Audio Visual Means ("OAVM") facility in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules framed thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 21/2021, 02/2022, and 11/2022 dated 8th April, 2020, 13th April, 2020, 5th May, 2020, 13th January, 2021, 14th December 2021, 5th May, 2022 and 28th December, 2022 and latest being General Circular No. 09/ 2023 dated 25th September, 2023 respectively issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Securities and Exchange Board of India Circular No. SEBIHO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020, SEBI/HO/CFD/CMD2/CIR/P/ 2021/11 dated 15th January, 2021, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13th May, 2022 and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated 05th January, 2023 and latest being SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated 7th October, 2023 ("SEBI Circulars"), to transact the business as set out in the Notice convening the AGM without the physical presence of the Members at a common venue.

The Notice of the AGM and the Annual Report for the financial year 2023-24 including the Financial Statements for the year ended 31st March, 2024 ("Annual Report") will be sent only through e-mail to all those Members, whose email addresses are registered /updated with the Company or with their respective Depository Participants in accordance with the MCA Circulars and the SEBI Circulars. Members can join and participate in the AGM through VC /OAVM facility only. The instructions for joining the AGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-voting system during the AGM are provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The Notice of the AGM and the Annual Report will also be available on the website of the Company at www.vishalfabricsltd.com and the websites of stock exchange where the securities of the Company are listed i.e. BSE Limited at www.bseindia.com.

Members who have not registered their email address will be able to cast their vote electronically on the business as set out in the Notice of the AGM either remotely (during remote) e-voting period) or during the AGM as per the manner provided in the Notice to Members.

If your email address is registered with the Company /Depository Participants the login credentials for remote e-voting are being sent on your registered email address. Please note that same login credentials are required for participating in the AGM through VC /OAVM and voting on resolutions during the AGM. If your email address is not registered, you are requested to get the same registered /updated

by contacting their respective Depository Participants. The above information is being issued for the information and benefit of all the Members of the

Company and is in compliance with MCA Circulars and the SEBI Circulars.

Sd/-Pooja Dhruve

For, Vishal Fabrics Limited

**Company Secretary** 

Place: Ahmedabad

financialexp.epapr.in

**Date**: 03/08/2024

**VACATION NOTICE** 

Acvas

egd. & Corp. Office: 201-202, 2nd Floor, South End Square, Mansarovar Industrial Area, Jaipur, 30202 Notice is hereby given to the applicant and Co-applicant/Guarantors - Rakesh Bhansinh Kusuha, Mrs. Vimalaben Kushvaha, Mr. Vijaybhai Solanki, to vacate the movable articles in the property situated at Revenue Survey No. 1202/3, Block No. 41, "Vrundavan Park Society", Village Karjan, Sub-Dist. Karjan, Dist. Vadodara, Gujarat Admeasuring 61.72 Sq. Mtrs. The possession of which is taken by Aavas Financiers Limited on 30 Jan 2022 under section 13(4) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, within the period of 7 days from the date of publication of this notice. Please take note that if you fall to vacate the movable articles, Aavas Financiers Limited (Formerly known as "Au Housing Finance Ltd."), will be constrained to auction the property along with movable articles lying in the property at your own cost and consequences and Aavas Financiers Limited, will not be responsible for the same.

Date : 03/08/2024 **Authorised Officer** Place : Jaipur Aavas Financiers Limited

APPENDIX IV-A

Sale Notice for sale of Immovable Property

E-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable Property mortgaged to Sammaan

Capital Limited (formerly known as Indiabulls Housing Finance Ltd.) [CIN L65922DL2005PLC136029] ("Secured Creditor"), the physical possession of which has been taken by the Authorised Officer of the Secured Creditor, will be sold on "as is where is", "as is what is" and "whatever there is" basis on 06.09.2024 from 04.00 P.M. to 05.00 P.M., for recovery of Rs. 27,71,812/- (Rupees Twenty Seven Lakh Seventy One Thousand Eight Hundred Twelve only) pending towards Loan Account No. HHLSUR00343603, by way of outstanding principal, arrears (including accrued late charges) and interest till 27.07.2024 with applicable future interest in terms of the Loan Agreement and other related loan document(s) w.e.f. 28.07.2024 along with legal expenses and other charges due to the Secured Creditor from ASHVINBHAI VASRAMBHAI SAVAJ and CHANDRIKABEN SAVAJ.

The Reserve Price of the Immovable Property will be Rs. 18,07,000/- (Rupees Eighteen Lakh Seven Thousand only) and the Earnest Money Deposit ("EMD") will be Rs. 1,80,700/- (Rupees One Lakh Eighty Thousand Seven Hundred only) i.e. equivalent to 10% of the Reserve Price.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

RESIDENTIAL PLOT NO. 78, (PLOT NO 65 & 66 PAIKI AS PER PLAN), HAVING AREA 336.53 SQ. MTRS., MARUTIDHAM SOCIETY, NEAR DADA BHAGWAN MANDIR, KAMREJ, SURAT - 395006, GUJARAT. For detailed terms and conditions of sale, please refer to the link provided on the

website of the Secured Creditor i.e. www.sammaancapital.com; Contact No: 0124-6910910, +91 7065451024; E-mail id: auctionhelpline@sammaancapital.com. For bidding, log on to www.auctionfocus.in.

**AUTHORISED OFFICER** SAMMAAN CAPITAL LIMITED Place: SURAT (Formerly known as INDIABULLS HOUSING FINANCE LTD.)

> POSSESSION NOTICE (for immovable property)

Whereas,

The undersigned being the Authorized Officer of INDIABULLS COMMERCIAL CREDIT LIMITED (CIN: U65923DL2006PLC150632) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 06.02.2023 calling upon the Borrower(s) MEHTA DIPAK PRAVINCHANDRA ALIAS DIPAK PRAVINCHANDRA MEHTA PROPRIETOR SHIV TRADING, RANJANBEN P MEHTA, MEHTA SHIVANGI DIPAKKUMAR ALIAS SHIVANGI DIPAKKUMAR MEHTA AND MEHTA PRAVIN SUNDERLAL ALIAS PRAVIN SUNDERLAL to repay the amount mentioned in the Notice being Rs. 87,18,226.77 (Rupees Eighty Seven Lakhs Eighteen Thousand Two Hundred Twenty Six and Paise Seventy Seven Only) against Loan Account No. HLLABRH00447499 as on 06.02.2023 and interest thereon within 60 days from the date of receipt of the said Notice.

The Borrower(s) having failed to repay the amount, Notice is hereby given to the Borrower(s) and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on 01.08.2024.

The Borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of INDIABULLS COMMERCIAL CREDIT LIMITED for an amount of Rs. 87,18,226.77 (Rupees Eighty Seven Lakhs Eighteen Thousand Two Hundred Twenty Six and Paise Seventy Seven Only) as on 06.02.2023 and

The Borrowers' attention is invited to provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the Secured Assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

ALL THAT PIECE AND PARCEL OF PROPERTY LYING, BEING AND SITUATED ON THE LAND BEARING NON-AGRICULTURAL PLOT OF LAND IN MOUJE BHOLAV, BHARUCH LYING BEING LAND BEARING REVENUE SURVEY NO. 91 PAIKKI, PLOT NO. 22 ADMEASURING 135.00 SQ, MTR. I.E. 1452.60 SQ, FT. ASHIRWAD BUNGALOWS, NADELAY ROAD, SITUATED IN THE LIMIT OF MOUJE-BHOLAV, DISTRICT-BHARUCH, GUJARAT AND IS BOUNDED AS FOLLOWS:

EAST : BY SUB PLOT NO. 11 BY SOCIETY ROAD NORTH : BY SUB PLOT NO. 23 SOUTH : BY SUB PLOT NO. 21

Date: 01.08.2024 **Authorised Officer** Place: BHARUCH INDIABULLS COMMERCIAL CREDIT LIMITED સેક્શન ૧ ૩ના સબ-સેક્શન (૮) તરફ દેણદારનું ધ્યાન દોરવામાં આવે છે.

### પરિશિષ્ટ IV-એ,

સ્થાવર મિલકતના વેચાણ માટે સૂચના

सिड्योरीटी रिन्ट्रेस्ट (એन्डोर्समेन्ट) એક्ट **2002**ना नियम **8(6)** मु%ज सिड्योरिटार्छ्रेशन એन्ड રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટ્રેસ્ટ એક્ટ 2002

હેઠળ સ્થાવર મિલકતના વેચાણ માટે ઈ-ઓક્શન વેચાણ સૂચના. આ દ્વારા સામાન્ય જનતાને અને ખાસ કરીને કર્જદાર(રો) અને ગૅરંટર(રો)ને સૂચના આપવામાં આવે છે કે, નીચે વર્ણન કરેલ સ્થાવર મિલકત કે જે **સમ્માન કૅપિટલ લિમિટેક (આ પહેલા ઈન્ડિયાબુલ્સ** હાઉસિંગ ફાઈનાન્સ લિ. તરીકે ઓળખાતી) [CIN : L65922DL2005PLC136029] ("સીક્યોર્ડ **કેડિટર'')** પાસે ગીરવે મુકેલ છે જેનો **વાસ્તવિક કબજો** સીક્યોર્ડ ક્રેડિટરના અધિકૃત અધિકારી દ્વાર લેવામાં આવ્યો છે તે **ર. 27,71,812/- (રૂપિયા સત્યાવીસ લાખ એકોત્તેર હજાર આઠસો બાર પૂરાં)** ર્ન પસૂલી માટે 06.09.202**4** ના રોજ **સાંજના 04.00 થી 05.00 વાગ્યા** દરમિયાન **''જેમ છે'' ''જયોં છેં'' ''જેમ છે જે છે''** અને જે પણ જ્યાં છે ધોરણે વેચવામાં આવશે, જે **અશ્વિનભાઈ વસરામભાઈ સાવજ** અને ચંદ્રિકાબેન સાવજ પાસેથી લોન અકાઉન્ટ નં. HHLSUR00343603 માં બાકી નીકળતી મૂળ

રકમ, એરીઅર્સ (જમા થયેલા લેટ ચાર્જિસ સહિત) તેમ જ **27.07.2024** સુધીનાં વ્યાજ સહિત લોન એગ્રીમેન્ટ અને અન્ય સંબંધિત લોન દસ્તાવેજ(જો)ની શરતો મુજબ **28.07.2024** થી અમલી બને તેમ લાગુ ભાવિ વ્યાજ ઉપરાંત કાનૂની ખર્ચ અને અન્ય ચાર્જિસ સહિત સીક્ચોર્ડ ક્રેડિટર્સને ચૂકવવાના બાકી સૂચિત પ્રોપર્ટીઓના ઓક્શન માટે અનામત કિંમત **રૂ. 18,07,000/- (રૂપિયા અઢાર લાખ સાત હજાર** 

પૂરાં) છે. અને અર્નેસ્ટ મની ડિપોઝિટ ("ઇએમડી") રૂ. 1,80,700/- (રૂપિયા એક લાખ એસી હજાર સાતસો પૂરાં) એટલે અનામત મૂલ્ય 10 % ના બરાબર રહેશે

સ્થાવર મિલકત્તનું વર્ણન

રહેણાંક પ્લૉટ નં. 78 (પ્લૉટ નં. 65 અને 66 પૈકી પ્લાન મુજબ), જે 336.53 ચો. મીટર વિસ્તાર ધરાવે છે અને મારતિધામ સોસાયટી, દાદા ભગવાન મંદિર પાસે, કામરેજ, સરત - 395006 ગુજરાત ખાતે આવેલ છે.

વેચાણના વિસ્તૃત નિયમો અને શરતો માટે કૃપા કરી સીક્યોર્ડ ક્રેડિટર એટલે કે www.sammaancapital.com ની વેબસાઇટ પર આપેલી લિંક જુઓ; સંપર્ક નં. 0124 - 6910910, +91 7065451024; ઈ-મેઈલ આઈડી : auctionhelpline@sammaancapital.com ଜାଞ୍ଚିମ માટે www.auctionfocus.in પર લૉંગ ઑન કરો.

તારીખ: 30.07.2024 સ્થળ : સુરત

અધિકૃત અધિકારી સમ્માન કૅપિટલ લિમિટેડ (આ પહેલા ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિ. તરીકે ઓળખાતી)

### NOTICE

NOTICE is hereby given that the Certificate(s for 410 Equity Shares of face value Rs.10/- o olio number - 1000001533, Certificate No 2010510. Dist. Nos. from 19352171 to 19352580 Of The Associated Cement Company (ACC) Limited Standing in the name(s) of Indravadan Kanchanlal Kotha ointly with Surendra Kanchanlal Kothari ANI he Certificate(s) for 190 Equity Shares of fac value Rs.10/- of folio number - S000015418 Certificate No-2012525, Dist. Nos. fron 11545021 to 41545210 Of The Associate Cements Company (ACC) Limited Standing in the name(s) of Surendra Kanchanlal Kotha ointly with Indravadan Kanchanlal Kotha has been lost or mislaid and the undersigne has/have applied to the Company to issu duplicate Certificate(s) for the said shares. Any person who has a claim in respect of the said hares should lodge such claim with the Company at its Registered Office- Associated ements Company (ACC) Limited., Adan orporate Park, Shantigram, S. G. Highway Khodiyar, Ahmedabad — 382421within one month from this date else the company wil proceed to issue duplicate Certificate(s).

Names of the Applicants:-02/08/2024 1) Manish Surendra Kothari 2) Rashmi Vinod Shah 3) Ragini Harshad Saraiya 4) Piyush Harivadanlal Shah 5) Hetvi Abhi Prajapati 6) Bhavik Piyushbhai Shah

## % Chola ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ Enter a better life કોર્પોરેટ ઓફિસ: ચોલા કેસ્ટ, સુપર બી, સીપ૪ અને સીપપ, ૪, થીરૂ વી કા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગિન્ડી, ચેન્નાઈ ૬૦૦૦૩૨

પરિશિષ્ટ ૪ [લુઓ નિયમ ૮(૧)] કબજા નોટીસ (સ્થાવર મિલક્ત માટે) આથી **ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ**ના અધિકૃત અધિકારી તરીકે નીચે સહી કરનાર, ધી સિક્ચોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ના ૫૪) અને સેક્શન ૧૩(૧૨)ને ધી સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાણે લેતાં હેઠળ મળેલ સત્તાની રૂએ દેણદાર ને એક ડિમાન્ડ નોટિસ મોકલી હતી નોટિસમાં જણાવેલ રકમ અને તેના પરનું વ્યાજ ઉપરોક્ત નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવેલ. દેણદાર આ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલ છે, જેથી દેણદારો અને જાહેર જનતાને આ નોટિસથી જણાવવામાં આવે છે કે નીચે વર્ણવેલ મિલકતોનો નીચે સહી કરનારે તેને મળેલ સદર કાયદાના સેક્શનના સબ સેક્શન (૪) સેકશન ૧૩ ને ધ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ હેઠળ મળેલ સત્તાની રૂએ **ક્લબ્**રો લીધો છે. દેણદારને વિશેષ રૂપે અને અને જાહેર જનતાને સામાન્ય રીતે સૂચિમાં જણાવેલ મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથેના કોઈ પણ સોદા ધિરાણ અને તેના પરના વ્યાજ સાથે **મેસર્સ ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ** 

**ફાઇનાન્સ કંપની લિમિટેડ**ના ચાર્જમાં ગણાશે. સિક્ચોર્ડ અસ્ક્ચામતો છોડાવવાની ઉપલબ્ધતા સમયમર્યાદા અંગે સરફેસી કાયદાના

દેણદારનું નામ અને સરનામું ક્લજાન બાકી રકમ કબજાવાળી મિલકતનું વર્ણન નોટીસની अने Gोन એકाઉन्ट नं. તારીખ Loan A/c Nos.HL23STR000085593 સ્થાવર મિલકત ના તમામ હક હિસ્સા સાથે ફલેટ નં. થી બાબુભાઈ ગોવિંદભાઈ આંબલીયા ૨૧૯૯૮૪૪/-૧૦૧, પહેલો માળ, કે જેનું ક્ષેત્રફળ ૯૯૫.૦૦ ચો. ફુટ શ્રીમતી હેતલબેન આંબલીયા (અંકે રૂપિયા એટલે કે ૯૨.૪૩૫૫ ચો.મી. સુપર બિલ્ટ એપ એરીયા શ્રી સાગર આંબલીયા એકવીસ લાખ પ૯.૯૭૬ ચો.મી., બિલ્ટ એપ એરીયા સાથે શ્રી ચશ આંબલીયા વણવહેંચાયેલ હિસ્સા સાથે જમીન, રોડ અને સીઓપી, નવાણું હજાર **બધા રહે** : પ્લોટ ૪/૫, ફલેટ નં. ૧૦૧ ખાઠસો ચોર્યાસી જયભવાની કોમ્પલેક્ષના બાંધકામના પ્લોટ નં. ૪ અને પ જય ભવાની કોમ્પલેક્ષ, સિંગણપોર, કતારગામ પુરા) તારીખ જે રણછોડનગર કો.ઓ.હા.સોસાયટી ના રેવન્યુ સર્વે નં. સુરત, પાર્થ કોમ્પલેક્ષ સામે, સુરત-૩૯૫૦૦૪. ૫૦૫/૨-૧ ટીપી સ્કીમ નં. ૧૮, એફપીનં. ૯૦ પૈકી .૧-૦૫-૨૦૨૪ **અહીં પણ** : આર. એસ. નં. ૫૦૫/૨-૧, મોજે કતારગામ, ડિસ્ટ્રીક સુરત સીટી, ડીસ્ટ્રીક સુરત. (૧) હેતલબેન બાબુભાઈ આંબલીયા અને (૨) ટીપીએસ નં. ૧૮, એફ નં. ૯૦, એફ નં.૧૦૧ પહલો, પીનં ૪ અને ૫, પાર્થ કોમ્પલેક્ષ સામે, બાબુભાઈ ગોવિંદભાઈ આંબલીયાની માલિકી છે. નીચે સિંગણપોર રોડ, જયભવાની કોમ્પલેક્ષ, પ્રમાણે ચતુર્સીમા છેઃ પૂર્વ તરફઃ- ફલેટ નં. ૧૦૨, પશ્ચિમ તરફઃ- આશરે પેસેજ, ઉત્તર તરફઃ- આશરે બિલ્ડીંગ, રણછોડનગર કો.ઓ. હા. સોસાયટી લિ., દક્ષિણ તરફઃ- પેસેજ કતારગામ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૪.

> અધિકૃત અધિકારી, મેસર્સ ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ

## IDEOCON

### **VIDEOCON INDUSTRIES LIMITED**

CIN: L99999MH1986PLC103624 Regd. office: 14 K.M. Stone Aurangabd Paithan Road, Chittegaon, Tal. Paithan, Dist. Aurangabad 431 105 Email: secretarialvg.in@gmail.com Website: www.videoconindustriesite

## NOTICE OF THE 33rd ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

NOTICE is hereby given that the Thirty-third Annual General Meeting ("AGM") of the Members of VIDEOCON INDUSTRIES LIMITED (Company under Corporate Insolvency Resolution Process) will be held on Monday, 26th day of August, 2024, Insolverly Resolution Process will be ried of inwoludy, 20th day of August, 2024, at 11:15 a.m. at the Registered Office of the Company at 14 KM Stone, Aurangabad Paithan Road, Village Chittegaon Taluka Paithan Dist. Aurangabad 431 105 Maharashtra (AGM) to transact the business as set out in Notice convening the AGM. The copies of the Notice of AGM together with the Annual Report for the financial year ended on 31st March, 2023, is being sent by electronic mode to all the members whose email addresses are registered with the Company / Depository Participant(s) for communication purposes. The Notice of the AGM and the Annual Report of the Company for the financial year ended on 31st March, 2023 is also being made available on the website of the Company viz. www.videoconindustriesItd.com

www.videoconindustriesItd.com Notice is further given that pursuant to the provisions of section 91 of the Companies Act 2013, read with Rule 10 of the Companies (Management & Administration) Rules 2014 and Regulation 42 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation 2015, the Register of Members and Share Transfer Books of the company shall remain closed from Tuesday, 20th August, 2024 to Monday, 26th August, 2024 (both days inclusive) for the purpose of the AGM.

In terms of and in compliance with the provisions of Section 108 of the Companie Act, 2013 Read with Rule 20 of the Companies (Management & Administration) Rules 2014 as amended from time to time and Regulation 44 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation 2015, notice is further given

The business set out in the notice are also being transacted through voting by electronic means (remote e-voting). For this purpose the Company has made arrangements with Central Depository Services Limited (CDSL) for facilitating e-voting to enable the members to cast their votes electronically. Detailed procedure and instructions for remote e-voting have been annexed to the Notice of the ensuing AGM. The members can cast their vote through remote e-voting facility provided by CDSL. The company is also providing facility for voting by ballot at the AGM apart from providing remote e-voting facility for all those members who are present at the AGM but have not casted their votes by availing the remote e-voting facility. A member may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in AGM.

The communication relating to remote e-voting inter-alia containing the User Id and password along with the copy of the notice conveying the AGM forms part of the Annual Report.

The remote e-voting shall commence on Friday, 23rd August, 2024 at 9:00 a.m

In the remote e-voting snall commence on Friday, 23rd August, 2024 at 9:00 a.m. and shall end on Sunday, 25th August, 2024 at 5:00 p.m. (both dates inclusive). The remote e-voting shall not be allowed beyond the said date and time.

The Company has fixed Monday, 19th August, 2024 as the cut-off date entitlement date for Identifying the members for determining the eligibility to vote by electronic means or at AGM by ballot. A person whose name is recorded

in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM.

Any person who acquires shares and becomes member of the Company after the date of dispatch of notice of AGM and holding shares on the cut-off date 'entitlement date' i.e. Monday, 19th August, 2024 may obtain the login ID and Decouract from Mo. Suitab Parch Company Secretor, 3 Compliance Officer, 6 Password from Ms. Sujata Parab, Company Secretary & Compliance Officer o Password from Ms. Sujata Parab, Company Secretary & Compliance Unicer of the Company, who is responsible to address the grievances connected with the facility for voting by electronics means by sending an email request to secretarialvg.in@gmail.com. Members may also call on 9619894307 or send a request to the Company by writing at secretarialvg.in@gmail.com.

In case of queries, if any, with regard to remote e-voting; members may refer the frequently asked questions (FAQ) for members and e-voting user manual for members available at the downloaded section of www.evotingindia.com.or.call on toll free number 1800225533 or send a request at

### elpdesk.evoting@cdslindia.com By order of the Board of Directors of VIDEOCON INDUSTRIES LIMITED

olvency Resolution Process

SÚJATA PARAB

COMPANY SECRETARY & COMPLIANCE OFFICER MEMBERSHIP NO. A 48113

Place: Mumbai

Date: 02nd August, 2024 (Videocon Industries Limited is under Corporate Insolvency Resolution Process pursuant to the provisions of the Insolvency and Bankruptcy Code, 2016. With effect from September 25, 2019, its affairs, business and assets are being managed by and the powers of the board of directors are vested in the Resolution Professional, Mr. Abhijit Guhathakurta, appointed by Hon'ble National Compan LawTribunal, Mumbai Bench, Mumbai)

### **VIDEOCON INDUSTRIES LIMITED**

તા. : ૩૦-૦७-૨૦૨૪

સ્થળ : સુરત

CIN: L99999MH1986PLC103624 Regd. office: 14 k.M. Stone Aurangabd Paithan Road, Chittegaon, Tal. Paithan, Dist: Aurangabad- 431 105 Email: secretarialvg.in@gmail.com Website: www.videoconindustriesitr

## NOTICE OF THE 32nd ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

NOTICE is hereby given that the Thirty Second Annual General Meeting ("AGM") of the Members of VIDEOCON INDUSTRIES LIMITED (Company under Corporate Insolvency Resolution Process) will be held on Monday, 26th day of August, 2024, at 10:30 a.m. at the Registered Office of the Company at 14 KM Stone, Aurangabad Paithan Road, Village Chittegaon Taluka Paithan Dist. Aurangabad -431, 105 Maharashtra (AGM) to transact the business as set out in Notice convening the AGM. The copies of the Notice of AGM together with the Annual Report for the financial year ended on 31st March, 2022, is being sent by electronic mode to all the members whose email addresses are registered with the Company. the members whose email addresses are registered with the Company

Depository Participant(s) for communication purposes. The Notice of the AGM and the Annual Report of the Company for the financial year ended on 31st March, 2022 is also being made available on the website of the Company viz. www.videoconindustriestId.com

Notice is further given that pursuant to the provisions of section 91 of the Companies Act 2013, read with Rule 10 of the Companies (Management & Administration) Rules 2014 and Regulation 42 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation 2015, the Register of Members and Share Transfer Books of the company shall remain closed from Tuesday, 20th August, 2024 to Monday, 26th August, 2024 (both days inclusive) for the purpose of the AGM.

In terms of and in compliance with the provisions of Section 400-XIII.

n terms of and in compliance with the provisions of Section 108 of the Companie Act, 2013 Read with Rule 20 of the Companies (Management & Administration Rules 2014 as amended from time to time and Regulation 44 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation 2015, notice is further giv

The business set out in the notice are also being transacted through voting by electronic means (remote e-voting). For this purpose the Company has made arrangements with Central Depository Services Limited (CDSL) for facilitating e-voting to enable the members to cast their votes electronically. Detailed procedure and instructions for remote e-voting have been annexed to the Notice of the ensuing AGM. The members can cast their vote through remote e-voting facility provided by CDSL. The company is also providing facility for voting by ballot at the AGM apart from providing remote e-voting facility for all those members who are present at the AGM but have not casted their votes by availing members who are present at the AGM but have not casted their votes by availing the remote e-voting facility. A member may participate in the AGM even afte exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in AGM.

The communication relating to remote e-voting inter-alia containing the User Ic and password along with the copy of the notice conveying the AGM forms part of the Annual Report.

The remote e-voting shall commence on Friday, 23rd August, 2024 at 9:00 a.m. and shall end on Sunday, 25th August, 2024 at 5:00 p.m. (both dates inclusive). The remote e-voting shall not be allowed beyond the said date and time. The Company has fixed Monday, 19th August, 2024 as the cut-off date inclusive that the company has fixed Monday, 19th August, 2024 as the cut-off date.

'entitlement date' for Identifying the members for determining the eligibility to vote by electronic means or at AGM by ballot. A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM.

Any person who acquires shares and becomes member of the Company after

the date of dispatch of notice of AGM and holding shares on the cut-off date 'entitlement date' i.e. Monday, 19th August, 2024 may obtain the login ID and Password from Ms. Sujata Parab, Company Secretary & Compliance Officer of the Company, who is responsible to address the grievances connected with the facility for voting by electronics means by sending an email request to secretarialvg.in@gmail.com. Members may also call on 9619894307 or send a request the Company burnified at constraints in Membel on the Company and the Company burnified at constraints. request to the Company by writing at secretarialvg.in@gmail.com.

In case of queries, if any, with regard to remote e-voting; members may refer the frequently asked questions (FAQ) for members and e-voting user manual for toll free number 1800225533 or send a request at helpdesk.evoting@cdslindia.com

## By order of the Board of Directors of VIDEOCON INDUSTRIES LIMITED

SÚJATA PARAB

COMPANY SECRETARY & COMPLIANCE OFFICER MEMBERSHIP NO. A 48113 Place: Mumbai

Date: 02nd August, 2024

Videocon Industries Limited is under Corporate Insolvency Resolution Proces (Videocon Industries Limited is under Corporate insolvency Resolution Process pursuant to the provisions of the Insolvency and Bankruptcy Code, 2016. With effect from September 25, 2019, its affairs, business and assets are being managed by and the powers of the board of directors are vested in the Resolution Professional, Mr. Abhijit Guhathakurta, appointed by Hon'ble National Company Law Tribunal, Mumbai Bench, Mumbai)

### **VIDEOCON INDUSTRIES LIMITED**

CIN: L99999MH1986PLC103624

Regd. office: 14 K.M. Stone Aurangabd Paithan Road, Chittegaon,
Tal. Paithan, Dist: Aurangabad- 431 105

Email: secretarialy,ln@gmail.com Website: www.videoconindustriesitd

## NOTICE OF THE 30th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

NOTICE is hereby given that the thirtieth Annual General Meeting ("AGM") of the Members of VIDEOCON INDUSTRIES LIMITED (Company under Corporate Insolvency Resolution Process) will be held on Monday, 26th day of August, 2024, at 09:00 a.m. at the Registered Office of the Company at 14 KM Stone, Aurangabad Paithan Road, Village Chittegaon Taluka Paithan Dist. Aurangabad -431 105 Maharashtra (AGM) to transact the business as set out in Notice convening the AGM. The copies of the Notice of AGM together with the Annual Report for the figancial ways and a 31st March 2020 is being sent by electronic mode to all inancial year ended on 31st March, 2020, is being sent by electronic mode to a the members whose email addresses are registered with the Company of Depository Participant(s) for communication purposes. The Notice of the AGM and the Annual Report of the Company for the financial year ended on 31st March 2020 is also being made available on the website of the Company viz www.videoconindustriesltd.com

www.videoconindustriesltd.com Notice is further given that pursuant to the provisions of section 91 of the Companies Act 2013, read with Rule 10 of the Companies (Management & Administration) Rules 2014 and Regulation 42 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation 2015, the Register of Members and Share Transfer Books of the company shall remain closed from Tuesday, 20th August, 2024 to Monday, 26th August, 2024 (both days inclusive) for the purpose of the AGM.

n terms of and in compliance with the provisions of Section 108 of the Compani Act, 2013 Read with Rule 20 of the Companies (Management & Administration) Rules 2014 as amended from time to time and Regulation 44 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation 2015, notice is further giver

The business set out in the notice are also being transacted through voting b electronic means (remote e-voting). For this purpose the Company has made arrangements with Central Depository Services Limited (CDSL) for facilitating evoting to enable the members to cast their votes electronically. Detailed procedure and instructions for remote e-voting have been annexed to the Notice of the ensuing AGM. The members can cast their vote through remote e-voting facility provided by CDSL. The company is also providing facility for voting by ballot at the AGM apart from providing remote e-voting facility for all those members who are present at the AGM but have not casted their votes by availing the remote e-voting facility. A member may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in AGM.

The communication relating to remote e-voting inter-alia containing the User I and password along with the copy of the notice conveying the AGM forms part of the Annual Report.

The remote e-voting shall commence on Friday, 23rd August, 2024 at 9:00 a.m and shall end on Sunday, 25th August, 2024 at 5:00 p.m. (both dates inclusive)

and shall end on Sunday, 25th August, 2024 at 5:00 p.m. (both dates inclusive). The remote e-voting shall not be allowed beyond the said date and time.

The Company has fixed Monday, 19th August, 2024 as the cut-off date entitlement date' for Identifying the members for determining the eligibility to vote by electronic means or at AGM by ballot. A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date only shall be entitled to avail the

by the Depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM.

Any person who acquires shares and becomes member of the Company after the date of dispatch of notice of AGM and holding shares on the cut-off date 'entitlement date' i.e. Monday, 19th August, 2024 may obtain the login ID and Password from Ms. Sujata Parab, Company Secretary & Compliance Officer of the Company, who is responsible to address the grievances connected with the facility for voting by electronics means by sending an email request to secretarialyg.in@gmail.com. Members may also call on 9619894307 or send a request to the Company by writing at secretarialyg.in@gmail.com.

In case of queries, if any, with regard to remote e-voting; members may refer the frequently asked questions (FAQ) for members and e-voting user manual for

rs available at the download section of www.evotingindia.com or call of toll free number 1800225533 or send a request a

## By order of the Board of Directors of VIDEOCON INDUSTRIES LIMITED

lvency Resolution Process)

SU/JTA PARAB COMPANY SECRETARY & COMPLIANCE OFFICER MEMBERSHIP NO. A 48113

Place: Mumbai Date: 02nd August, 2024

Videocon Industries Limited is under Corporate Insolvency Resolution Process bursuant to the provisions of the Insolvency and Bankruptcy Code, 2016. With effect from September 25, 2019, its affairs, business and assets are being managed by and the powers of the board of directors are vested in the Resolution rofessional, Mr. Abhijit Guhathakurta, appointed by Hon'ble National Company w Tribunal. Mumbai Bench, Mumbai)

## इंडियन बैंक 🦝 Indian Bank

સ્ટેસ્ડ એએટસ મેનેજમેન્ટ શાખા. રજો માળ. દેસના શોપીંગ કોમ્પલેસ, ઉસ્માનપુરા ચૌરાહા, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪, મો. ૮૪७૮૯૩७૮૪७ ઇ-મેલ : armbahmedabad@indianbank.co.in

ઇ-હરાજી વેચાણ નોટીસ અનુકમણિકા-A પરિશિષ્ટ-IV-A" (જુઓ રુલ ૮ (૬)ની જોગવાછ) સ્થાવર મિલકતના વેચાણ માટેની નોટિસ ક્ડ રીકન્સ્ટ્રક્શાન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોસંમેન્ટ ઓફ <u>સિક્સોરિટી લ્યાને</u> (એન્ફોસંમેન્ટ) રુત્સ, ૨૦૦૨ના રુલ ૮૯૬ ાલ્સિયલ એસેટ્સ એન્ડ એનફોસંમેન્ટ ઓફ સિક્ગોરિટી ઇન્ટરેસ્ટ એક્ડ, ૨૦૦૨ની સાથે સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ ૨૨ના રુલ ૮(૬) ને વાંચતા સ્થાવર મિલકતના વેચાણ માટે ઇ-ઓક્શન વેચાણ નોટિસ સિક્ચોરિટાઇઝેશન એન્ડ રીક

આથી ખાસ કરીને દેવાદાર( રો ) અને જામીનદાર( રો ) અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર મિલકત સિક્ચોર્ડ લેણદારને ગીચે/ચાર્જડ કરાચેલ છે , જેનો **ઇન્ડિયન બેંક, અમદાવાદ ,** સિક્ચોર્ડ લેણદારના અધિકૃત અધિકારીએ **ભોતિક કબજો** લઇ લીધો છે, જેનું **ઇન્ડિયન બેંક, અમદાવાદ ,** સિક્ચોર્ડ લેણદારની **તા. ૦૫.૧૦.૨૦૨૩** મુજબની બાકી ૨૬મ **રા. ૧૧,૬૧,૬૦,૨૦૬/- (રૂપિયા અગિયાર કરોડ એકાણુ લાખ સાઈઠ હજાર બસો છ પુરા) ની વસુલાત માટે "જ્યાં છે", "જે છે", "જેમ છે"** ના ધોરણે **તા. ૨૧.૦૮.૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૨:૦૦ કલાક સુધી** વેચાણ કરવામાં આવશે .

ક્રમ તં.	દેવાદારો / જામીનદારો / ગીરવેદારોનું નામ અને સરનામું	મિલકતનું વિગતવાર વર્ણન	રિઝર્વ કિંમત / ઇએમડી / બીડ વૃદ્ધિની સ્ક્રમ	પ્રોપર્ટી આઇડી નં./ કબજાનો પ્રકાર
1	(ગુજરાત)-૩૮૪૨૪૦.૨) શ્રી પ્રકાશકુમાર સી. સિંઘલ (ભાગીદાર અને જમીનદાર), બી-૪૦૧, ઇશાન રેસિડેન્સી, ન્યુ સી.જી.રોડ, ચાંદખેડા, ગાંદીનગર, અમદાવાદ (ગુજરાત)-૩૮૪૨૪૦.૨) શ્રી પ્રકાશકુમાર સી. સિંઘલ (ભાગીદાર અને જામીનદાર), બી-૪૦૧, ઇશાન રેસિડેન્સી, ન્યુ સી.જી.રોડ, ચાંદખેડા, ગાંદીનગર, અમદાવાદ (ગુજરાત)-૩૮૨૪૨૪.૩) શ્રી ચિરાગકુમાર સાર. પ્રજપતિ (ભાગીદાર અને જામીનદાર), અમૃતપુરા, મૃ. પોસ્ટ-હારીજ, તા. હારીજ, જી. પાટણ, (ગુજરાત)-૩૮૪૨૪૦.૪) શ્રી મોહનજી આર. ઠાકોર (જામીનદાર), ઠાકોર વાસ, ધનપુરા, જરનાંગ, આંબલિયાસણ, જી. મહેસાણા (ગુજરાત)-૩૮૨૭૩૨.૫) મે. સિદ્ધિ ઇન્ડ્સ્ટ્રીઝ (ભાગીદારો પેઢી અને જામીનદાર) તેના ભાગીદારો દ્વારા, સરનામુ: જમનાપુર હાઇવે, તા. હારીજ, જી. પાટણ (ગુજરાત)-૩૮૪૨૪૦.૫.૧) શ્રી પ્રકાશકુમાર સી. સિંઘલ (મે. સિદ્ધ ઇન્ડ્સ્ટ્રીઝના ભાગીદાર), બી-૪૦૧, ઇશાન રેસિડેન્સી, ન્યુ સી.જી.રોડ, ચાંદખેડા, ગાંદીનગર, અમદાવાદ (ગુજરાત)-૩૮૨૪૨૪.૫.૨) શ્રી મોહનજી આર. ઠાકોર, (મે. સિદ્ધિ ઇન્ડ્સ્ટ્રીઝના ભાગીદાર), ઠાકોર વાસ, દાનપુરા, જરનાંગ, આંબલિયાસણ, જી. મહેસાણા (ગુજરાત)-૩૮૨૭૩૨.	તમામ પીસ અને પાર્સલ ધારક સર્વે નં. ૭૨૦/૨પી૨પી, જે આવેલ છે. હારીજ સીમ, તા. હારીજ, જી. પાટણ, ગુજરાત રાજ્ય આશરે ૧૧૮૯૨.૦૦ ચો.મી. ચતુઃસીમા : ઉત્તરે : સર્વે	ઈએમડી	IDIB277500287 ભોતિક કબજો

ઈ-ઓક્શન મોડ દ્વારા વેચાણ માટે લાવવાના ઈરાદાવાળી પ્રોપર્ટીની ચોક્ક્સ વિગતો નીચે મુજબ છેઃ

મિલકત પરનો બોજો ઃ નથી ● ઇ-હરાજીની તારીખ અને સમય ઃ ૨૧.૦૮.૨૦૨૪ ના રોજ સવારે ૧૧ઃ૦૦ થી બપોરે ૦૨ઃ૦૦ સુધી ઈ-હરાજી ની સેવા પ્રદાતા ઃ https://www.ebkray.in સંપર્ક : ૧. શ્રી રોહિત રંજન, મોબાઈલ નં. ૮૪७૮૯૩७૮૪७, ૨. શ્રી મહિપાલસિંહ રાજપુરોહિત, મોબાઈલ નં. ७०૧૮૯૦૯૯७૯

બીડરોને ઓનલાઇન બીડમાં ભાગ લેવા માટે અમારા ઈ-હરાજા સર્વિસ પ્રદાતા **પીએસબી એલાયન્સ પ્રાઈવેટ લીમીટેડ**. ટેકનીકલ સહાય માટે ફોન. **૮૨૯૧૨૨૨૨૦** પર કોલ કરવા વિનંતી છે. રજાસ્ટ્રેશન સ્ટેટસ અને ઇએમડી સ્ટેટસ માટે ઈ-મેઈલ support.ebkray@psballiance.com. નો સંપર્ક કરવા વિનંતી છે .

મિલકતની વિગતો અને મિલકતના ફોટોગ્રાફ તથા હરાજીની શરતો અને નિયમો માટે https://www.ebkray.in ની મુલાકાત લેવા વિનતી છે અને આ પોર્ટલ સંબંધિત સ્પષ્ટતાઓ માટે કોન્ટેક **પીએસબી એલાન્સ પ્રાઇવેટ લીમીટેડ इोन : ८२६१२२०२२०** पर सपंर्ड डरवा विनंती छे.

**QR Code** 


બીડરોને https://www.ebkray.in વેબસાઇટ પર મિલકત શોધતી વખતે ઉપર જણાવેલ પ્રોપર્ટી આઇડી નંબરનો ઉપયોગ કરવા સલાહ છે.


## બેંકની વેબસાઈટ www.indianbank.in

તારીખ : ૩૦.૦७.૨૦૨૪ | સ્થળ : અમદાવાદ

ઈ-હરાજીની વેબસાઈટ https://www.ebkray.in









અધિકૃત અધિકારી, ઈન્ડિયન બેંક

### **VIDEOCON INDUSTRIES LIMITED**

CIN: L99999MH1986PLC103624

Regd. office: 14 K.M. Stone Aurangabd Paithan Road, Chittegaon,
Tal. Paithan, Dist. Aurangabad - 431 105

Email: secretarialvg.in@gmail.com Website: www.videoconindustriesIt /ID€OCO∩

## NOTICE OF THE 31st ANNUAL GENERAL MEETING, EMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSU

NOTICE is hereby given that the Thirty First Annual General Meeting ("AGM") of the Members of VIDEOCON INDUSTRIES LIMITED (Company under Corporate nsolvency Resolution Process) will be held on Monday, 26th day of August, 2024 at 09:45 a.m. at the Registered Office of the Company at 14 KM Stone, Aurangabad Paithan Road, Village Chittegaon Taluka Paithan Dist. Aurangabad -431 105 Maharashtra (AGM) to transact the business as set out in Notice convening the AGM. The copies of the Notice of AGM together with the Annual Report for the financial year ended on 31st March, 2021, is being sent by electronic mode to a the members whose email addresses are registered with the Company / Depository Participant(s) for communication purposes. The Notice of the AGM and the Annual Report of the Company for the financial year ended on 31st March, 2021 is also being made available on the website of the Company viz. www.videoconindustriesItd.com

www.videoconindustriesltd.com Notice is further given that pursuant to the provisions of section 91 of the Companies Act 2013, read with Rule 10 of the Companies (Management & Administration) Rules 2014 and Regulation 42 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation 2015, the Register of Members and Share Transfer Books of the company shall remain closed from Tuesday, 20th August, 2024 to Monday, 26th August, 2024 (both days inclusive) for the purpose of the

In terms of and in compliance with the provisions of Section 108 of the Companie Act, 2013 Read with Rule 20 of the Companies (Management & Administration) Rules 2014 as amended from time to time and Regulation 44 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation 2015, notice is further given

The business set out in the notice are also being transacted through voting by electronic means (remote e-voting). For this purpose the Company has made arrangements with Central Depository Services Limited (CDSL) for facilitating evoting to enable the members to cast their votes electronically. Detailed procedure and instructions for remote e-voting have been annexed to the Notice of the ensuing AGM. The members can cast their vote through remote e-voting facility provided by CDSL. The company is also providing facility for voting by ballot at the AGM apart from providing remote e-voting facility for voting by ballot at the AGM apart from providing remote e-voting facility for all those members who are present at the AGM but have not casted their votes by availing the remote e-voting facility. A member may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in AGM.

The communication relating to remote e-voting inter-alia containing the User Ic and password along with the copy of the notice conveying the AGM forms part o

and password along with the copy of the notice conveying the AGM forms part of the Annual Report.

ii. The remote e-voting shall commence on Friday, 23rd August, 2024 at 9:00 a.m. and shall end on Sunday, 25th August, 2024 at 5:00 p.m. (both dates inclusive). The remote e-voting shall not be allowed beyond the said date and time.

v. The Company has fixed Monday, 19th August, 2024 as the cut-off date 'entitlement date' for Identifying the members for determining the eligibility to vote by electronic means or at A6M by ballot. A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM.

v. Any person who acquires shares and becomes member of the Company after the date of dispatch of notice of AGM and holding shares on the cut-off date 'entitlement date' i.e. Monday, 19th August, 2024 may obtain the login ID and Password from Ms. Sujata Parab, Company Secretary & Compliance Officer of the Company, who is responsible to address the grievances connected with the facility for voting by electronics means by sending an email request to facility for voting by electronics means by sending an email request to secretarialvg.in@gmail.com. Members may also call on 9619894307 or send a request to the Company by writing at secretarialvg.in@gmail.com.

In case of queries, if any, with regard to remote e-voting; members may refer the frequently asked questions (FAQ) for members and e-voting user manual for pembers and e-voting user manual for pembers and e-voting user manual for pembers and e-voting the pembers and e-voting user manual for the pembers and e-voting

members available at the download section of <u>www.evotingindia.com</u> or call or toll free number 1800225533 or send a request a

## By order of the Board of Directors of VIDEOCON INDUSTRIES LIMITED

Company under Corporate Insolvency Resolution Process)

SUJATA PARAB

COMPANY SECRETARY & COMPLIANCE OFFICER
MEMBERSHIP NO. A 48113

Date: 02nd August, 2024

Date: 02rld August, 2024 (Videocon Industries Limited is under Corporate Insolvency Resolution Process pursuant to the provisions of the Insolvency and Bankruptcy Code, 2016. With effect from September 25, 2019, its affairs, business and assets are being managed by and the powers of the board of directors are vested in the Resolution Professional, Mr. Abhijit Guhathakurta, appointed by Hon'ble National Company Law Tribugal Mumbai Broach Mumbai: Law Tribunal, Mumbai Bench, Mumbai)

### **CARBO-CERAMICS LIMITED**

CIN: L26999WB1902PLC001537 31, CHOWRINGHEE ROAD, KOLKATA - 700016 Phone No. 033-2265-9742, Fax No.: 033-2249-6420 www.carbo-ceramics.com, email: secretarial@carbo-ceramics.com

### **PUBLIC NOTICE - ANNUAL GENERAL MEETING BOOK CLOSURE AND E-VOTING INFORMATION**

Notice is hereby given that the 122nd Annual General Meeting of the Company will be held on Wednesday, the 28th day of August, 2024 at 11.00 a.m. IST through Video Conference ("VC") / other Audio Visual Means ("OAVM") to transact the business, as set out in the notice of the AGM as permitted by General Circular No. 09/2023 dated September 25, 2023 read together with other previous Circulars issued by Ministry of Corporate Affairs (MCA) in this regard (collectively referred to as "MCA Circulars").

The Notice of the AGM along with the Annual Report 2023-24 will be sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/ Depositories in accordance with the aforesaid MCA Circulars. Members may note that the Notice of the AGM and Annual Report 2023-24 will also be available on the Company's website: www.carbo-ceramics.com

The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Tuesday the 20th day of August, 2024 to Wednesday, the 28th day of August, 2024 (both days inclusive)

Facility for e-voting provided by Link Intime India Private Limited (LIIPL) is available for members to enable them cast their vote by electronic means on all the resolutions set out in the Notice of AGM

In accordance with Rule 20 of the Companies (Management & Administration) Amendment Rules, 2015, the Company has fixed Wednesday, August 21, 2024 as "cut-off date" to determine the eligibility of Members to vote by electronic means or at the AGM. A person whose name is recorded in the Register of members of the company or in the Statement of Beneficial Owners maintained by the depositories as on the cut-off date, i.e. August 21, 2024, only shall be entitled to avail the facility of e-voting or vote at the AGM.

The remote e-voting period commences on Sunday, August 25, 2024 at 9.00 a.m. (IST) and ends on Tuesday, August 27, 2024 at 5.00 p.m. (IST). During this period, Members may cast their vote electronically The remote e-voting module shall be disabled by LIIPL thereafter. Those Members, who shall be present in the AGM through VC / OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through remote e-voting system during the AGM. Detailed procedure for remote e-voting/e-voting during AGM is provided in the Notice of

If your e mail id is already registered with the Company/Depository Participant, login details for e-voting will be sent on your registered e Members who are holding shares in physical form or who have not

registered their email addresses with the Company/Depositories can obtain login credentials for evoting as per following procedure: For Physical Shareholders - Please provide Folio No. , Name of

shareholders, scanned copy of the Share Certificate (front and back page), PAN (self certified scanned copy of PAN Card), AADHAAR (self - certified scanned copy of Aadhaar Card) by email to rnt.helpdesk@linkintime.co.in For Demat shareholders - Please provide DPID-CLID (16 digit DPID

+ CLID or 16 digit beneficiary ID) Name, client master or copy of Consolidated Account Statement, PAN (self-certified scanned copy of PAN Card), AADHAAR (self-certified scanned copy of Aadhaar Card) by email to rnt.helpdesk@linkintime.co.in For the process and manner of e-voting (both remote e-voting and

voting at the time of AGM) and also for attending the AGM through VC OAVM, members may go through the instructions in the Notice

convening AGM and In case you have any queries or issues regarding e-voting, You may send an email to instameet@linkintime.co.in or contact on: - Tel: 08108118484.

Members having any grievance connected with e-voting and AGM may contact the following:

: Mr. Rajiv Ranjan Name Designation : Assistant Vice President - Evoting Address

Place : Kolkata Date : 01.08.2024

: Link Intime India Pvt. Ltd., C 101, 247 Park, L B S Marg, Vikhroli (W), Mumbai 400 083 Phone No. 022 49186060

Email id : enotices@linkintime.co.in

For Carbo-Ceramics Limited K. Biyani Company Secretary



# કર્ણાટક-ઓડિશાના વીજ પ્રોજેક્ટને વિક્રમ સમયમાં મંજૂરીઃ વીજ મંત્રાલય

પીટીઆઇ

નવી દિલ્હી, તા. ૨

ઓડિશામાં ૬૦૦ મેગાવોટ પ્રોજેક્ટ)ની સહમતિ પ્રક્રિયાને એક નિવેદનમાં જણાવ્યું હતું. કર્ણાટકમાં ૨,૦૦૦ મેગાવોટ (લગભગ ૬૦ મેગાવોટ)ની અધિનિયમ ૨૦૦૩ની કલમ ૮ વિકાસને પ્રાથમિકતા આપી છે. અપર ઇન્દ્રાવતી બે હાઇડ્ડો પંપ ઝડપી બનાવવા સીઇએ નિવેદન અનુસાર ઓડિશામાં શરાવતી કેપીસીએલ (કર્ણાટક સંખ્યાબંધ દરખાસ્તો પ્રાપ્ત થઇ હેઠળ સંમતિ માટે સીઇએ નેશનલ વીજ યોજના વીજ મંત્રાલયે આજે જણાવ્યું સ્ટોરેજ પ્લાન્ટનીા વિગતવાર પીએસપી અને તેના સંમતિના ૬૦૦ મેગાવોટની અપર સરકારના એકમ) દ્વારા છે. તમામ વિકાસકર્તાઓ વેબસાઇટ પર અપલોડ કરવામા (જનરેશન) અનુસાર ૨૦૩૧-હતું કે સેન્ટ્રલ ઇલેક્ટ્રીસિટી પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી આપી ડીપીઆર (વિગતવાર પ્રોજેક્ટ ઇન્દ્રાવતીનો વિકસાવવામા આવી રહી છે. ડીપીઆરતૈયાર કરવાના વિવિધ આવશે. મંત્રાલય અનુસાર ૩૨ સુધીમા બીઇએસએસ

ઓથોરિટી (સીઇએ) રેડોર્ક છે. ભારત સરકારની બિઝનેસ અહેવાલ)ની તૈયારી માટે પ્રક્રિયા ઓએચપીસી લિમિટેડ (ઓડિશા સઇએ અને ડીપીઆર તૈયાર તબક્કામાં છે. ડીપીઅરા તૈયાર સરકારે દેશની ઉર્જા સુરક્ષા સહિત ઉર્જા સંગ્રહ પ્રણાલીઓની સમયમાં કર્ણાટકમાં ૨,૦૦૦ ઝુંબેશની સરળતા અનુસાર સરળ કરવાની માર્ગદર્શિકામાં સરકારનો એક ઉપક્રમ) દ્વારા કરવા માટે સર્વેક્ષણ અને તપાસ કર્યા પછી આ પીએસપી સુનિશ્વિત કરવા માટે ઉર્જા સંગ્રહ સ્થાપિત ક્ષમતા ૭૪ મેગાવોટ



### RDB REALTY & INFRASTRUCTURE LTD. CIN: L16003WB2006PLC110039

Regd. Office: Bikaner Building, 8/1, Lal Bazar Street, 1st Floor Room No- 10 Kolkata-700001, Ph No (033) 44500500, Fax: 033-22420588

Email id :secretarial@rdbindia.com; Website: www.rdbindia.com EXTRACT OF REVISED AUDITED FINANCIAL RESULT FOR THE QUARTER

	(Rs. In Lakhs)			
Particulars	Quarter ended 31.03.2024	Year ended 31.03.2024	Quarter ended 31.03.2023	
	(Audited)	((Audited)	(Audited)	
Total income from operations (net)	3684.59	6784.05	4246.01	
Net Profit before Tax and				
exceptional items	(7.29)	360.02	119.11	
Net Profit before Tax after				
exceptional items	(7.29)	360.02	119.11	
Net Profit/loss after Tax	(8.69)	270.17	106.91	
Fotal Comprehensive Income for the period (Comprising profit for the period after tax and other				
omprehensive income after tax)	(8.69)	270.17	106.91	
Paid-up Equity Share Capital Face Value Rs. 10/- Per Share)	1728.34	1728.34	1728.34	
Reserves (As shown in the	2014.23	2014.23	1745.22	
Audited Balance Sheet of	(as on	(as on	(as or	
previous year)	31/03/24)	31/03/24)	31/03/23	
Basic and Diluted Earning Per Share for the period	(0.05)	1.56	0.62	

### The above result was reviewed by the Audit Committee on 2nd August, 2024 and approved by the Board of Directors of the Company at its meeting held on 2nd August, 2024.

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Stock Exchange(s) and on the company's website (www.rdbindia.com).

FOR AND ON BEHALF OF THE BOARD Neera Chakravarty DIN:09096844

Place: Kolkata

## बैंक ऑफ़ बड़ौदा <mark>કુકાસણ શાખા :</mark> શોપ નં. ૧–૫, સ્વાગત રેઈન ફોરેસ્ટ–૧, કોબા રોડ, કુકાસણ, ગાંધીનગર–૩૮૨૪૨૧. Ph. 079-23600929, Email : kudasan@bankofbaroda.com કબજાની નોટીસ - સ્થાવર મિલકત માટે

આથી નીચે સહી કરનાર **બેંક ઓફ બરોડા**ના અધિકૃત અધિકારીએ સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ નો ૫૪ રૂલ) (હવેથી આને આપણે કાયદો કહીશું) અને **કલમ ૧૩(૧૨)** ની મળેલ સત્તાની રૂએ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ ના **રૂલ ૩** સાથે ના મેળલ સત્તાના રૂઝા લિક્યુલા છહ્ટાદર (અનરાકાનાન્ડ) રહા, ૧૦૦૧ ના રૂપ ઇ હા... વાંચતાતા. ૧૮.૦૩.૨૦૨૪ ના રોજ ડિમાન્ડ નોટીસ આપીને ઉઘારકર્તા (૧) મે. આકાશ એન્ટરપ્રાઈઝ, શ્રી કૃણાલભાઈ મધુકરભાઈ મેવાડાની માલિકીની પેઢી (૨) શ્રી કૃણાલભાઈ મધુકરભાઈ મેવાડા (માલિક) (ઉદ્યારકર્તા અને માલિક) ને નોટીસમાં જણાવેલ બાંકી રકમ રૂા. ૯૦,૪૪,૦૬७.૮૩ (રૂા. નેવું લાખ યુગ્માલીસ હજાર સક્સઠ અને ત્યાંસી પૈસા) સાથે ૧૭.૦૩.૨૦૨૪ થી ટર્મ લોન અને કેશ કેડીટ લોન નું વ્યાજ ઉપરાંત ભવિષ્યનું વ્યાજ અને **ખર્ચાઓ સહિતની રકમ** આ નોટીસ મળ્યાના **૬૦ દિવસમાં** પરત ચુકવવા જણાવ્યું હતું.

આથી ઉદ્યારકર્તા સદર રકમ બેંકને પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી ઉદ્યારકર્તા/ જામીનદાર/ કાચદેસરના વારસદારો અને જાહેર જનતાને નોટીસ આપીને જણાવવામાં આવે છે કે આથી ન<sup>ી</sup>ચે સહી કરનારે નીચે જણાવેલ મિલકતનો **સરફેસી કાયદાની કલમ ૧૩ (૪) અને** તેના રૂલ ૮ અને ૯ સાથે વાંચતા તેઓને મળેલ સત્તાની રૂએ તા. 0૧.૦૮.૨૦૨૪ ના રોજ સાંકેતિક કબજો લઈ લીધો છે.

આથી ઉદ્યારકર્તા અને જાહેર જનતાને આથી ચેતવણી આપી જણાવવામાં આવે છે કે તેઓ સદર મિલકત અંગે કોઈપણ વ્યવહાર ના કરે અને તેમ છતાં પણ કોઈ તેમ કરશે તો તેઓ **બેંક ઓફ** બરોડા પાસેથી લીધેલ બાકી રકમ **રૂા. ૯૦,૪૪,૦૬**७.૮**૩ (રૂા. નેવુ લાખ ચુમ્માલીસ હજાર** સકસઠ અને ત્યાંસી પૈસા) સાથે ૧७.૦૩.૨૦૨૪ થી ટર્મ લોન અને કેશ ક્રેકીટ લોન નું વ્યાજ **ઉપરાંત ભવિષ્યનું વ્યાજ અને ખર્ચાઓ સહિતની રકમ** બેંકને ચૂકવવા સારૂ બંધનકર્તા રહેશે. ઉદ્યારકર્તાઓને ખાસ ધ્યાન દોરવાનું કે સરફેસી કાયદાની કલમ ૧૩(૮) ની જોગવાઈ અનુસાર આપેલ સમયમર્ચાદામાં કાયદાનુસાર તેમની સલામત મિલકત પાછી મેળવી શકે છે.

## સ્થાવર મિલકતનું વર્ણન

મિલકતનો ખંડ કે ભાગ બધું જ એટલેકે ઔદ્યોગિક શેડ નં. ૯૬, પ્લોટનું ક્ષેત્રફળ ૯૩.૪૬ ચો.મી., અને તેના ઉપર ૮૨.૨૨ ચો.મી. નું બાંઘકામ પ્લેટીનમ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક વિભાગ-૧ ની બિન–ખેતીલાયક જમીન આશરે ૯૧૦૫ ચો.મી. જેનો સવે નં. ૧૦૩૦ અને સંયક્ત સવે નં ૧૦૩७, ટીપી સ્કીમ નં. ૮७, એફપી નં. ૨७ જેનું કુલ ક્ષેત્રફળ ૭૮૮૫૨ ચો.મી. માંથી ૨૬૬૧७ ચો.મી. ક્ષેત્રફળ નો સબ પ્લોટ નં. ૧, મૌજે : વટવા સ્થિત, તાલુકો : વટવા, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદ અને ૨જીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૧ (અસલાલી) (CERSAI Security ID - 200285836402). જેની આજુબાજુ : પૂર્વમાં ચુનિટ શેક નં. ૮૭. પશ્ચિમમાં કોમન રોડ, ઉત્તરમાં યુનિટ શેડ નં. ૯७, દક્ષિણમાં યુનિટ શેડ નં. ૯૫.

- બી. ગીરોમકેલ પ્લાન્ટ અને મશીનરી જે શેડ નં. ૨૯. નંદાવન ઈન્ડસ્ટીયલ એરીયા બાકરોલ, અમદાવાદ, ગુજરાત–૩૮૨૪૩૩ ખાતે મૂકેલ છે. (CERSAl Security ID
- સી. ગીરોમૂકેલ સ્ટોક અને ચોપડે દેવા. (CERSAI Security ID 200297459116).
- ડી. પ્લાન્ટ અને મશીનરીઓની વિગતો : (૧) ૫૦એમએમ અને ૫૫ એમએમ એચએમ એલએલડીપી બે લેચર પ્લાસ્ટીક એક્સટ્રડર ટ્યુબીંગ ફિલ્મ પ્લાન્ટ - ર સેટ (૨) ફ્લી ઓટોમેટીક પ્લાસ્ટીક એક્સટુકર પ્લાસ્ટીક બેગ કટીંગ અને સીલીંગ મશીન – ૧ સેટ (3) પ્લાસ્ટીક પેકેજીંગ પ્રોડક્ટ્સ પંચીંગ મશીન અને ૨૪ ડાઈ સેટ્સ – ૧ સેટ.

ગુંજન શર્મા અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા



बैंक ऑफ़ बड़ौदा शेंड, કુકાસણ, ગાંધીનગર–૩૮૨૪૨૧. Ph. 079-23600929 Email : kudasan@bankofbaroda.com

## કબજાની નોટીસ - સ્થાવર મિલકત માટે

આથી નીચે સહી કરનાર **બેંક ઓફ બરોડા**ના અધિકૃત અધિકારીએ સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ નો ૫૪ રૂલ) (હવેથી આને આપણે કાયદો કહીશું) અને કલમ ૧૩(૧૨) ની મળેલ સત્તાની રૂએ સિક્યુરીટી ઈન્ટેરેસ્ટ (એનફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ ના **રૂલ ૩** સાથે વાંચતા તા. ૨૯.૦૪.૨૦૨૪ ના રોજ ડિમાન્ડ નોટીસ આપીને ઉદ્યારકર્તા (૧) મે. જે. વી. એન્ટરપ્રાઈઝ, શ્રીમતી રીનાબેન કૃણાલભાઈ મેવાડાની માલિકીની પેઢી (૨) શ્રીમતી રીનાબેન કૂર્ણાલભાઈ મેવાડા જે શ્રી કૂરણાલભાઈ મેવાડાની પત્ની (ઉદ્યારકર્તા અને માલિક) ને નોટીસમાં જણાવેલ બાકી રકમ રૂા. ૯૪,૯૨,૨૨૪.૩૯ (રૂા. ચોરાણું લાખ બાણું હજાર બર્સ્સો ચોવીસ અને ઓગણચાલીસ પૈસા) સાથે ૨૭.૦૪.૨૦૨૪ થી ટર્મ લોન અને કેશ કેડીટ લોન નું <mark>વ્યાજ ઉપરાંત ભવિષ્યનું વ્યાજ અને ખર્ચાઓ સહિતની રકમ</mark> આ નોટીસ મળ્યાના **૬૦ દિવસમાં** પરત ચુકવવા જણાવ્યું હતું.

આથી ઉદ્યારકર્તા સદર રકમ બેંકને પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા हોવાથી ઉદ્યારકર્તા જામીનદાર/ કાયદેસરના વારસદારો અને જાહેર જનતાને નોટીસ આપીને જણાવવામાં આવે છે કે આથી નીચે સહી કરનારે નીચે જણાવેલ મિલકતનો **સરફેસી કાયદાની કલમ ૧૩ (૪) અને** તેના રૂલ ૮ અને ૯ સાથે વાંચતા તેઓને મળેલ સત્તાની રૂએ તા. 0૧.૦૮.૨૦૨૪ <mark>ના રોજ</mark> સાંકેતિક કબજો લઈ લીધો છે.

આથી ઉદ્યારકર્તા અને જાહેર જનતાને આથી ચેતવણી આપી જાગાવવામાં આવે છે કે તેઓ મદર મિલકત અંગે કોઈપણ વ્યવહાર ના કરે અને તેમ છતાં પણ કોઈ તેમ કરશે તો તેઓ **બેંક ઓક** બરોડા પાસેથી લીધેલ બાકી રકમ રૂા. ૯૪,૯૨,૨૨૪.૩૯ (રૂા. ચોરાણું લાખ બાણું હજાર બસ્સો ચોવીસ અને ઓગણચાલીસ પૈસા) સાથે ૨૭.૦૪.૨૦૨૪ થી ટર્મ લોન અને કેશ **ક્રેડીટ લોન નું વ્યાજ ઉપરાંત ભવિષ્યનું વ્યાજ અને ખર્ચાઓ સહિતની રકમ** બેંકને ચૂકવવા સા3 બંધનકર્તા રહેશે.

ઉદ્યારકર્તાઓને ખાસ ધ્યાન દોરવાનું કે સરફેસી કાયદાની કલમ ૧૩(૮) ની જોગવાઈ અનુસાર આપેલ સમયમર્યાદામાં કાયદાનુસાર તેમની સલામત મિલકત પાછી મેળવી શકે છે.

## સ્થાવર મિલકતનું વર્ણન

મિલકતનો ખંડ કે ભાગ બધું જ એટલેકે ઘંઘાકીય મિલકત ચુનિટ નં. ૩૦૫, ત્રીજો માળ, સૌજન્યકૃપા કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી જે અક્ષત કોમ્પલેક્ષ ના નામે ઓળખાય છે. જેનું બાંઘકામ ક્ષેત્રફળ ૪૪.૬૩ ચો.મી. (સુપર બિલ્ટઅપ એરીચા) અને ૧૩.૦૦ ચો.મી. નો જમીનનો અવિભાજ્ય ભાગ. જે પ્લોટ નં. બી સ્થિત, ફાઈનલ પ્લોટ નં. ૧૧૮, ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૧/બી, રેવન્યુ સર્વે નં. ૨૪૨/3/૧, ૨૪૨/3/૨, ૨૪૨/8, ૨૪૨/8, ૨૪૨/8, ૨૪૨/૬/૧ અને ૨૪૨/૬/૨, મોજે : બોડકદેવ, ઘાટલોડીયા તાલુકાની અંદર, ડિસ્ટ્રીક્ટ અમદાવાદ અને સબ કિસ્ટ્રીક્ટ અમદાવાદ-૩ (મેમનગર). (CERSAI Security ID 200305290530). જેની આજુબાજુ : પૂર્વમાં યુનેટ નં. ૩૦૬, પશ્ચિમમાં યુનિટ નં. ૩૦૪, ઉત્તરમાં ખુદ્દ્યો પ્લોટ, દક્ષિણમાં પેસેજ અને યુનિટ નં. ૩૦૧.

- બી. ગીરોમૂકેલ પ્લાન્ટ અને મશીનરી જે શેડ નં. એ-૧૬૫, નંદાવન ઈન્ડસ્ટ્રીયલ એરીયા,
- બાકરોલ, અમદાવાદ, ગુજરાત-3૮00૫0 ખાતે મૂકેલ છે. સી. ગીરોમૂકેલ સ્ટોક અને ચોપડે દેવા.
- પ્લાન્ટ અને મશીનરીઓની વિગતો : (૧) ૬૦એમએમ અને ૬૫ એમએમ એચએમ એલએલડીપી બે લેચર પ્લાસ્ટીક એક્સટ્રેડર ટ્યુબીંગ ફિલ્મ પ્લાન્ટ – ૨ સેટ (૨) કુદ્યી ઓટોમેટીક પ્લાસ્ટીક બેગ કટીંગ અને સીલીંગ મશીન – ૧ સેટ (૩) પ્લાસ્ટીક બેગ પંચીંગ મશીન સાથે ૧૨ મશીન કાઈ સેટ્સ – ૧ સેટ

તારીખ : ૦૧.૦૮.૨૦૨૪ સ્થળ : બોડકદેવ

ગુંજન શર્મા અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા

## **VASTU HOUSING FINANCE CORPORATION LIMITED**

Registered Office : 203/204,"A" Wing, 2nd Floor, Navbharat Estates, Zakaria Bunder Road, Sewri (West), Mumbai 400 015. CIN: U65922MH2005PLC272501, Tel:022 2419 0911, Website : www.vastuhfc.com

**EXTRACT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS** FOR THE QUARTER ENDED JUNE 30, 2024

			Standalone	
Sr. No.	Particulars	30.06.2024	Quarter ended 30.06.2023	Year ended 31.03.2024
		(Audited)	(Audited)	(Audited)
1	Total income from operations	25,706.61	21,847.05	101,527.03
2	Net profit / (loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	8,588.73	8,576.62	42,537.41
3	Net profit / (loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	8,588.73	8,576.62	42,537.41
4	Net profit / (loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	6,757.32	6,621.70	33,212.16
5	Total comprehensive income for the period [comprising profit/ (loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	6.700.78	6.618.29	33,202.24
6	Paid-up equity share capital	67,657.33	63,406.23	67,657.33
7	Reserves (excluding revaluation reserves)	114,913.38	80,791.03	107,999.21
8	Securities premium account	160,267.88	102,508.14	160,267.88
9	Net worth	342,838.59	246,705.39	335,924.42
10	Paid up debt capital/outstanding debt	418,365.58	328,256.21	388,012.72
11	Outstanding redeemable preference shares	N.A.	N.A.	N.A.
12	Debt equity ratio	1.22	1.33	1.16
13	Earnings per share (of ₹.100/- each) (Not annualised for the quarter)			
	Basic EPS (in ₹.)	9.99	10.44	52.24
	Diluted EPS (in ₹.)	9.55	9.93	49.74
14	Capital redemption reserve	N.A.	N.A.	N.A.
15	Debenture redemption reserve	N.A.	N.A.	N.A.
16	Debt service coverage ratio	N.A.	N.A.	N.A.
17	Interest service coverage ratio	N.A.	N.A.	N.A.

### Notes:

a) The above is an extract of the detailed format of audited quarterly financial results filed with the BSE imited under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015. The full format of audited quarterly financial results are available on the websites of BSE Limited and the Company at www.bseindia.com and www.vastuhfc.com respectively.

b) For the other line items referred in Regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, pertinent disclosures have been made to the BSE Limited and can be accessed at www.bseindia.com. The additional disclosures applicable to the Company under Regulation 52(4) of SEBI LODR are stated below:

Sr. No.	Particulars	Quarter ended 30.06.2024
1	Total debts to total assets (%)	53.11%
2	Operating margin (%)	33.41%
3	Net profit margin (%)	26.14%
4	Gross NPA (%)	1.22%
5	Net NPA (%)	0.89%
6	Liquidity coverage ratio (%)	181.06%
7	Provision coverage ratio (%)	69.64%
8	Security cover (debt) (No. of times)	1.16

c) Figures of the previous period/year have been regrouped/reclassified wherever necessary to conform o current period's classification / disclosure

For Vastu Housing Finance Corporation Limited

Sandeep Menon Place: Mumba Date: August 02, 2024

મેગાવોટનો શરાવતી અને હાઇડ્રો પીએસપી (પમ્પ્ડ સ્ટોરે વધુ સુધારો કર્યો છે, તેમ મંત્રાલયે કરવામા આવી રહ્યો છે અને હેઠળ હાઇડ્રો પીએસપી વિકાસકર્તાઓ દ્વારા વિજ પ્રણાલી ખાસ કરીને પીએસપીા થવાનો અંદાજ છે.



JAYSYNTH ORGOCHEM LIMITED (Formerly known as JD Orgochem Limited) CIN: L24100MH1973PLC016908

Registered Office: 301, Sumer Kendra, P. B. Marg, Worli, Mumbai – 400 018 **Email Id:** investor.relations@jaysynth.com : **Website:** www.jaysynth.com **Tel No.:** 022- 49384200/4300

### TRANSFER OF UNCLAIMED/UNPAID DIVIDEND AND EQUITY SHARES OF THE COMPANY TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF) AUTHORITY

Notice is hereby given to the Members of the Company that pursuant to Section 124(6) of the Companies Act, 2013 ("the Act") read with Rule 6 of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended ("the Rules") that all dividends remaining Unclaimed/Unpaid for a period of 7 (Seven) consecutive years from the date of transfer to Unpaid Dividend Account are required to be transferred by the Company to the Investor Education and Protection Fund (IEPF) Authority established by the Central Government.

In terms of the Rules, the final equity dividend declared by the erstwhile Jaysynth Dyestuff (India) Limited [Now merged with Jaysynth Orgochem Limited (Formerly known as JD Orgochem Limited) w.e.f. 03rd May, 2024] on 29th August. 2017 for the Financial Year 2016-17, which remains Unclaimed/Unpaid for a period of 7 (Seven) consecutive years and the shares of the Company [allotted in lieu of shareholding in erstwhile Jaysynth Dyestuff (India) Limited] in respect of which dividend has not been claimed for a period 7 (Seven) consecutive years are due to be credited in favour of IEPF on 04th October, 2024.

Members are requested to note that the dividend declared by the Company for the Financial Year 2016-17, which has remained Unclaimed/Unpaid for a period of 7 (Seven) consecutive years will be due for transfer to IEPF Authority on 04th October, 2024. The corresponding shares on which dividend remained Unclaimed/Unpaid for 7 (Seven) consecutive years will also be due for transfer along with the dividend referred above as per the procedure set out in

In compliance with the requirements of the said Rules, the Company has communicated individually to all those Members whose Unclaimed/Unpaid dividend and shares are liable to be transferred to the IEPF Authority at their registered addresses. The Company has also uploaded full details of those Members whose Unclaimed/Unpaid dividend and shares are liable to be transferred to the IEPF Authority on its website at www.jaysynth.com.

Concerned Members of the Company are hereby requested to claim the dividend declared during the Financial Year 2016-17 on or before 30th September, 2024, failing which the Company shall transfer the dividend for the Financial Year 2016-17 and the corresponding shares to the IEPF Authority without any further intimation.

Further please note that no claim shall lie against the Company in respect of Unclaimed/Unpaid dividend amount and shares transferred to IEPF Authority. The Members may claim the dividend and corresponding shares transferred to the IEPF Authority including all the benefits accruing on such shares, if any, from the IEPF Authority after following the procedure prescribed in the Rules.

For any queries/information/clarification in the subject matter, may write to us at:

Dilip Rajpurohit M/s. Link Intime India Private Limited C 101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai – 400 083 Email: rnt.helpdesk@linkintime.co.in Fax No. 022-4918 6060

Company Secretary and Compliance Officer Jaysynth Orgochem Limited 301, Sumer Kendra, P.B. Marg, Worli, Mumbai – 400 018 Email: investor.relations@jaysynth.com Tel No. 022-4938 4200/4300

For Jaysynth Orgochem Limited

Place: Mumbai Date: 02nd August, 2024

Riddhi Kunal Saraiya **Company Secretary and** Compliance Officer



## વિશાલ ફેબ્રીક્સ લીમીટેડ

**કોર્પોરેટ ઓફીસ:** શાંતિ કોર્પોરેટ હાઉસ, હીરા રૂપા હોલ પાસે,

બોપલ-આંબલી રોડ, અમદાવાદ-૩૮૦૦૫૮, ગુજરાત,

ફોન : +૯૧ ૯૦૯૯૯ પરપ૪૨; **દમેદલ:** cs.vfl@vishalfabrics.co.in; **વેબસાદર:** www.vishalfabricsltd.com

### 3૯ મી વાર્ષિક સામાન્ય સભા માટે સભ્યોને નોટીસ વ્હાલા સભ્યો,

આથી નોટીસ આપવામાં આવે છે કે વિશાલ ફેબ્રીક્સ લીમીટેડ (કંપની) ની ૩૯મી વાર્ષિક સામાન્ય સભા મંગળવાર, ૨૭ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સીંગ (વીસી)/ઓડિયો વિઝયુઅલ માધ્યમો 'ઓએવીએમ) સવલત મારકત કંપની કાયદા. ૨૦૧૩ અને તે હેઠળ બનેલ નિયમોની જોગવાઇઓ અને સિક્યોરીટા: ઝને એક્સરોન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્લાયરમેન્ટસ) નિયમનો, ૨૦૧૫ સાથે વંચાતા કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, ૧૭ /૨૦૨૦, ૨૦/૨૦૨૦ ૦૨/૨૦૨૧, ૨૧ /૨૦૨૧, ૦૨/૨૦૨૨ અને ૧૧/૨૦૨૨ અનુક્રમે તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦, ૫ મે, ૨૦૨૦ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧, ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧, ૫ મે, ૨૦૨૨ અને ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ અને તાજેતરના સામાન્ય પરિપત્ર નં. ૦૯/૨૦૨૩ તારીખ ૨૫ સપ્ટેમ્બ૨, ૨૦૨૩ (એમસીએ પરિપત્રો) અને સિક્ચોરીટીઝ અને એક્સરોન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પરિપત્ર નં. SEBIHO/CFD/CMD1/CIR/P/2020/79 તારીખ ૧૨ મે. ૨૦૨૦

SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 જાન્યુઆરી, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 તારીખ ૧૩ મે, ૨૦૨૨ અને SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 તારીખ ૦૫ જાન્યુઆરી, ૨૦૨૩ અને તાજેતનરના SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ (સેબી પરિપત્રો) ના અનુપાલન હેઠળ એક્જ સ્થળે સભ્યોની પ્રત્યક્ષ હાજરી વગર એજાએમ બોલાવતી નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે ચોજાશે.

એમસીએ અને સેબી પરિપત્રો અનુસાર એજીએમની નોટીસ અને નાણાંકિચ વર્ષ, ૨૦૨૩–૨૪નો વાર્ષિક અહેવાલ તેમજ 3૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ પુરા થતાં વર્ષના નાણાંકિય નિવેદનો (વાર્ષિક અહેવાલ) જેસભ્યોના ઈમેઇલ એડ્રેસો કંપર્ન અથવા તેમના સંબંધિત ડિપોઝીટીરી પાર્ટીશીપન્ટો પાસે ૨જીસ્ટર્ડ/સુધારાવેલ છે તેઓને ફક્ત ઇમેઇલ મારફત મોકલવામાં આવશે. સભ્યો ફક્ત વીસી/ઓએવીએમ સવલત મારફત એજીએમમાં જોડાઇ શકે છે અને ભાગ લઇ શકે છે. એજીએમમાં જોડવાની સુચનાઓ અને રીમોટ ઈલેક્ટ્રોનિક વોટીંગમાં ભાગ લેવાની રીત અથવા એજીએમ દરમિયાન ઈ–વોટીંગ સીસ્ટમ મારફત મત આપવાની રીત એજીએમની નોટીસમાં આપેલ છે. વીસી/ઓએવીએમ સવલત મારફત માગ લેનાર સભ્યોની કંપની કાયદા , ૨૦૧૩ની કલમ ૧૦૨ હેઠળ કોરમની ગણતરી કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે. એજાએમની નોટીસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.vishalfabricsltd.com અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટો જ્યાં કંપનીની સિક્ચોરીટઝ લિસ્ટેડ છે એટલે કે બીએસઈ લીમીટેડની www.bseindia.com ઉપર પણ ઉપલબ્ધ રહેશે.

જેસભ્યોએ તેમના ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર્ડ કરાવેલ નથી તેઓ સભ્યોની નોટીસમાં આપેલ રીત મુજબ રીમોટલી (રીમોટ ઈ–વોટીંગ ગાળા દરમિયાન) અથવા એજીએમ દરમિયાન એજીએમની નોટીસમાં જ્ણાવેલ કાર્યો પર ઇલેક્ટ્રોનિકલી

જો તમારા ઈમેઇલ એડ્રેસ કંપની/ડિપોઝીટરી પાર્ટિશીપન્ટ પાસે ૨જીસ્ટર્ડ છે, તો રીમોટ ઈ–વોટીંગની લોગિન વિગતો તમારા રજીસ્ટર્ડ ઇમેઇલ એડ્રેસ પર મોકલવામાં આવશે. નોંધ લેવી કે આજ લોગિન વિગતો વીસી/ઓએવીએમ મારફત એજીએમમાં ભાગ લેવા અને એજીએમ દરમિયાન મત આપવા માટે જરૂરી છે.

જો તમારા ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર્ડ નથી, તો તમને તમારા સંબંધિત ડિપોઝીટરી પાર્ટીશીપન્ટનો સંપર્ક કરીને તે રજસ્ટર્ડ/સુધારો કરાવા વિનંતી છે.

ઉપરોક્ત માહિતી કંપનીના તમામ સભ્યોની જાણકારી અને લાભાર્થે અને એમસીએ પરિપત્રો અને સેબી પરિપત્રોના વિશાલ ફેબ્રીક્સ લીમીટેડ વતી અનુપાલન હેઠળ જારી કરવામાં આવી રહી છે.

સ્થળઃ અમદાવાદ તારીખ: ૦૩/૦૮/૨૦૨૪

પૂજા દૃવે કંપની સેક્રેટરી





MRS. BECTORS FOOD SPECIALITIES LIMITED

Regd. Office: Theing Road, Phillaur, Jalandhar - 144410

Corporate Identity Number (CIN): L74899PB1995PLC033417, PAN: AABCM9495K

Website: www.bectorfoods.com, Email: atul.sud@bectorfoods.com Extract of Unaudited Standalone Financial Results for the Quarter ended 30th June 2024

Sr Particulars 30.06.2024 31.03.2024 31.03.2024 30.06.2023 (Unaudited) (Unaudited) (Audited) (Audited) Total Income from Operations 4,139.35 3,850.63 3,510.95 15,292.09 Net Profit Before Tax for the period 1,652.79 412.84 402.5 304.78 1,233.20 3 Net Profit after tax for the period 307.78 299.85 Total Comprehensive Income for the period 307.20 302.91 1.230.90 [Comprising Profit for the period ( after tax) and Other Comprehensive Income (after tax)] Paid-up Equity Share Capital 587.77 587.77 588.17 587.77 (Face value of Rs.10/- per share) 5,527.94 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet at 31st March 2024 Earnings Per Share (in Rs) (non annualised) Basic: 5.24 5 19 5 10 20.97 Diluted 5.24 5.18 5.10 20.96

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter ended 30th June 2024

(Rs. in million except					
Sr	Particulars		Quarter ended		
No		30.06.2024 (Unaudited)	31.03.2024 (Audited)	30.06.2023 (Unaudited)	31.03.2024 (Audited)
1	Total Income from Operations	4,444.24	4,130.24	3,787.04	16,429.54
2	Net Profit Before Tax for the period	475.32	452.07	467.66	1,882.82
3	Net Profit after tax for the period	354.26	336.16	348.50	1,403.61
4	Total Comprehensive Income for the period	353.59	334.02	348.35	1,401.02
	[Comprising Profit for the period (after tax) and				
	Other Comprehensive Income (after tax)]				
5	Paid-up Equity Share Capital	587.77	587.77	588.17	587.77
	(Face value of Rs.10/- per share)				
6	Reserves (excluding Revaluation Reserve) as				6,041.06
	shown in the Audited Balance Sheet at				
	31st March 2024				
7	Earnings Per Share (in Rs) (non annualised):			·	
	Basic:	6.03	5.72	5.93	23.87
1	Diluted:	6.03	5.70	5.93	23.85

## Notes:

The above unaudited consolidated financial results for the quarter ended 30 June 2024 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors on 2 August 2024. These results have been prepared in accordance with Indian Accounting Standards ('Ind AS') prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant rules thereunder and in term

The review report of the Statutory Auditors is being filed with the BSE Limited and National Stock Exchange of India Limited. For more details on unaudited consolidated financial results, visit financial performance section of our website www.cremica.in and financials results at corporate section at www.bseindia.com and www.nseindia.com.

of Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015 as amended.

- $3. \ \ \, \text{The Group is engaged in the single operating segment "food products"}.$
- 4. The figures for the last quarter ended 31 March 2024, as reported in these unaudited financial results, are the balancing figures between audited figures in respect of the full financial year and the published year to date figures upto the end of third quarter of the relevant financial year. Also, the figures upto the end of the third quarter had only been reviewed and not subject to audit.

For and on behalf of Board of Directors of Mrs. Bectors Food Specialities Limited

**Anoop Bector** Place: Phillaur Managing Director DIN: 00108589 Date: 02.08.2024